




P.07
પંજાબના પૂર્વ
મુખ્યમંત્રી કેપ્ટન
અમરિંદર સિંઘ
ભાજપમાં જોડાયા



P.07
રાજકારણમાં માત્ર
ગાદી પર બેસવા
આવ્યા નથી, લક્ષ્ય
સેવા: પીએમ મોદી

શશી યર- અશોક
ગઢેલાત કોંગ્રેસ પ્રમુખની
દેસમાં, રાહુલના નામને
લઈને અવટવ



21
SEPTEMBER - 2022
WEDNESDAY



નોઈડામાં
ભાઈન્ડ્રી વોલ
પડતાં ચાર
લોકોનાં મોત થયા

The Demand for Cyber Security Professionals at All-Time high across the world.

Learn from the Most Experienced Trainer and One of India's Top Ethical Hackers and Cyber Security Expert **Mr. FALGUN RATHOD** www.cyberoctet.com

Learn more than 110 Topics | Task and Research based Training | 100% Placement Assistance

+91 74053 21234

સમગ્ર ગુજરાત માટે ગૌરવ લેવા જેવા સમાચાર

ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' એ આ વર્ષની સુપરહિટ ફિલ્મો રાજમોલિની 'RRR' અને વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ' ને પણ પાછળ છોડી દીધી. સમગ્ર બોલીવુડને ચોંકાવી દીધું. ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિન મૂળ અમરેલી જિલ્લાના વતની...

અમરેલીનો વિશ્વકક્ષાએ ડંકો, પાન નલિનની ગુજરાતી ફિલ્મની ઓસ્કરમાં એન્ટ્રી

ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' આપતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે 'ઓસ્કર અવોર્ડ્સ'માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ'ની કટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે

અમદાવાદ, તા. ૨૦ | દરેક ગુજરાતીઓ ગૌરવ લઈ શકે તેવા સમાચાર સામે આવ્યા છે. મૂળ અમરેલી જિલ્લાના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી કમિંગ ઓફ એજ ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' (છેલ્લા શો)ને ઓસ્કર અવોર્ડ્સ માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. ગુજરાતી ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો'એ આ વર્ષની સુપરહિટ ફિલ્મો રાજમોલિની 'RRR' અને વિવેક અગ્નિહોત્રીની 'ધ કાશ્મીર ફાઇલ્સ' ને પણ પાછળ છોડી દીધી છે.

ગુજરાતી પાન નલિનની ફિલ્મ 'લાસ્ટ ફિલ્મ શો' આપતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા 'એકેડમી અવોર્ડ્સ' યાને કે 'ઓસ્કર અવોર્ડ્સ'માં ભારતનું પ્રતિનિધિત્વ કરશે અને 'બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ'ની કટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. ભારતમાં ૧૪ ઓક્ટોબરે આ 'છેલ્લા શો' ફિલ્મ રિલીઝ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, એસ. એસ. રાજમોલિની મેગનમ ઓપન ફિલ્મ 'RRR'ની જ ઓસ્કર માટે પસંદગી થશે. તેની સાથે કાશ્મીરી પંડિતોની વેદનાને વાચા આપતી અને બોક્સ ઓફિસ પર સરપ્રાઈઝિંગ રીતે સુપરહિટ જનારી વિવેક અગ્નિહોત્રીની અનુપમખેર-પલ્લવી જોશી સ્ટારર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' સિલેક્ટ થવાના પણ નક્કર ચાન્સ હતા. ભારતની ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી બનવા માટે તેલુગુ રોમેન્ટિક હિટ ફિલ્મ 'શ્યામ સિંધા રોય' પણ રેસમાં હતી.



સમગ્ર દેશમાં ૧૪ ઓક્ટોબરે 'છેલ્લા શો' ફિલ્મ રિલીઝ થશે

ભારતમાં પ્રોડ્યુસર સિદ્ધાંત ચોય કપૂર આ ફિલ્મ ૧૪ ઓક્ટોબરના રોજ રિલીઝ કરી રહ્યા છે. નવ વર્ષના બાળક સમય (બાલિવુડ રજા)ની વાર્તા કહેતી આ ફિલ્મ 'છેલ્લા શો' સિનેમાને પ્રેમ ત્ર ધ. સોરઠના નાનકડા ગામ ચલાલાના એક નાનકડા સિનેમા હોલના પ્રોપ્રિયેટરિસ્ટ ફગલ (ભાવેશ શ્રીમાળીની સાથે દોસ્તી કેળવીને ફિલ્મો જોનારા બાળકના સિનેમા પ્રલોના લગાવની આ દાર્શના છે. આ ફિલ્મની વાર્તા ૧૯૮૮માં આવેલી પચાતનામ ઘટાલિયન ફિલ્મ 'સિનેમા પ રેડિસો'ની યાદ આપે છે. આ ફિલ્મ પણ તે વર્ષનો બેસ્ટ ફોરેન લેવેજ ફિલ્મનો ઓસ્કર જીતી હતી. હોલિવુડના દિગ્ગજ ફિલ્મમેકર હોર્ગર્ટ ડી નિરો દ્વારા શરૂ કરાયેલા 'ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલ', સ્પેનના વેલાડોલિડ ફિલ્મ ફેસ્ટિવલ સહિતના આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવોમાં અદભૂત ઘનામો, પ્રશંસા અને કમર્શિયલ સફલતા પણ મેળવી ચૂકી છે.

યોમાસુ સત્રને લંબાવવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી

આજથી ગુજરાત વિધાનસભાનું ટુંકુ યોમાસુ સત્ર કોંગ્રેસ ડૂગસ, મોંઘવારી સહિતના મુદ્દે સરકારને ઘેરશે

અમદાવાદ, તા. ૨૦ | ગુજરાત વિધાનસભાના તા. ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરે મળનારા યોમાસુ સત્રને લંબાવવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી છે. વિધાનસભાની કામગીરી સલાહકાર સમીતીમાં કોંગ્રેસ આ મુદ્દે ઉઠાવાશે. વિધાનસભામાં વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સરકારે તેની જે નિષ્ફળતાઓ છે તેને છુપાવવા માટે વિધાનસભાનું ટુંકુ સત્ર બોલાવીને પ્રજાના પ્રશ્નો ચર્ચા નહી તેવો કારસો કર્યો છે. પરંતુ કોંગ્રેસ પક્ષ આ મુદ્દે સરકારને બીસમાં મુકશે અને રાજ્યને ડૂગનું પાટનગર બનાવી દેવાથી લઈને લકાડાં અને દારુના ખુલ્લેઆમ વેચાણ, કાયદો



અને વ્યવસ્થાની પરીસ્થિતિ સહિતના મુદ્દે સરકારને ઘેરશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતા દરેક રાજકીય પાર્ટીઓ એકસનમાં જોવા મળી રહી છે. ત્યારે ૨૭ વર્ષથી શાસન કરી રહેલી ભાજપ પણ પોતાનું વર્ચસ્વ જાળવવા મથામણ કરી રહી છે.

રાષ્ટ્રીય નેતા PM મોદી અને અમિત શાહ સહિતના નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધી રહ્યા છે. આ બધાની વચ્ચે આવતીકાલે ભાજપ ધારાસભ્ય ટળની બેઠક મળશે. માહિતી મુજબ વિધાનસભાના ટૂંકા સત્ર માટે આ બેઠક મળવાની છે. જેમાં ધારાસભ્યોને ૨ દિવસની કામગીરી અંગે માહિતી અપાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સહિત આગેવાનો હાજર રહેશે.

રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવામાં આવશે. છેલ્લા થ્રણ સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો.

ન્યૂઝ ટ્રિફ

જીએસટીએ ગુજરાત રાજ્યમાં પ્રથમ સુરતમાં એકસાથે ૨૦થી વધુ કેસ તૈયાર કર્યા

અમદાવાદ, તા. ૨૦ | જીએસટીના સવા પાંચ વર્ષ બાદ હવે ડિપાર્ટમેન્ટ મોટાપાયે ચાર્જીશીટ (પ્રોસિક્યુશન)ની શરૂ કર્યું છે. જીએસટીએ એકસાથે ૨૦થી વધુ કેસ તૈયાર કર્યા છે, જેમાં ૭ હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના ટ્રાન્ઝેક્શન હોવાનો ખુલાસો થયો છે. આ કાંડમાં ૨૩થી વધુ આરોપી છે. રાજ્યમાં પૃચ હજાર કરોડના બોગસ બિલિંગ શોધીને ૭ હજાર કેસ કરાયા છે. ડિપાર્ટમેન્ટ તપાસની સાથે સંકળાયેલાં તમામ પુરાવા રજૂ કરી રહ્યા છે. એસજીએસટીના સૂત્રો કહે છે કે અમદાવાદમાં એક કેસમાં ચાર્જીશીટ બાદ દ્રાવ્ય શરૂ થઈ છે.

જેતપુરમાં વિદ્યાર્થીઓએ આંદોલન કરતા લંપટ શિક્ષકની અટકાયત

રાજકોટ, તા. ૨૦ | જેતપુર શહેરમાં આવેલ કુંભાણી ગલ્સ હાઈ સ્કૂલના શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરતા હોવાની બાબતને લઈને વિદ્યાર્થીનીઓ રણરત્ની બની હતી અને આ મામલાથી નસ્ત થઈને વિદ્યાર્થીનીઓ દ્વારા શહેરમાં સુગોચ્યાર સાથે રેલી યોજાને ધરણા યોજવામાં આવ્યા હતા અને આ લંપટ શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

યુકેમાં ગેરકાયદે વસવાટ કરતા ભારતીયોને નક્કી દસ્તવેજો મોકલવાનું કોભાંડ બેંક ખાતા-નોકરી માટે ધાર્મિક ગ્રંથોમાં છુપાવીને નક્કી પાસપોર્ટ યુકે મોકલવાનું રેકેટનો પર્દાફાશ

આરોપીઓ અન્ય વ્યક્તિઓના ફોટો આઈડી કોપીનો ઉપયોગ કરી કુરિયરથી નક્કી પાસપોર્ટ મોકલતા હતા

અમદાવાદ, તા. ૨૦ | યુ.કે.માં ગેરકાયદેસર વસવાટ કરતા ભારતીયોને બેંક એકાઉન્ટ ખોલાવવા કે જોબ મેળવવા માટે જરૂર નક્કી પાસપોર્ટ ધાર્મિક ગ્રંથોમાં છુપાવી કુરિયર મારફતે મોકલવાનું રેકેટ ઝડપાયું છે. સીઆઈડી કાર્ડમાં આ ગુનાના બે મુખ્ય સૂત્રધાર યુ.કે. સ્થિત ચિરાગ પટેલ અને રાણીપના વિકાસ જયસ્વાલ વિરૂદ્ધ ૧૦ દિવસ અગાઉ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગતો મુજબ આરોપીઓ અન્ય વ્યક્તિઓના ફોટો આઈડી કોપીનો ઉપયોગ કરી કુરિયરથી નક્કી પાસપોર્ટ મોકલતા હતા. કુરિયર



કંપનીના સંચાલકે પોલીસને લેખિત અરજી આપી જેની તપાસમાં સમગ્ર ભાંડો ફટકો હતો. ફેક પાસપોર્ટ તૈયાર કરી ધાર્મિક ગ્રંથોમાં છુપાવી વિદેશ મોકલવાને રેકેટના મામલે સીઆઈડી કાર્ડમાં દસ દિવસ અગાઉ રાણીપ અજૂન

આશ્રમ પાસે રહેતા વિકાસ કનેચાલાલ જયસ્વાલ અને યુ.કે.માં રહેતા ચિરાગ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી વિકાસ જયસ્વાલ તેના મિત્ર ચિરાગ પટેલને ફેક પાસપોર્ટ કુરિયરથી યુ.કે. મોકલતો હતો. ભારતથી કુરિયર મારફતે કે મળતિયા મારફતે આવતા પાસપોર્ટ ધારકના ફોટો કાઢી ચિરાગ જે વ્યક્તિને પાસપોર્ટની જરૂર હોય તેનો ફોટો ચોટાડી દીધો હતો. આ રીતે પાસપોર્ટ આપવાના ચિરાગ લાખો રૂપિયા વસુલતો હતો. ચિરાગ પટેલ સાથે વિકાસ જયસ્વાલ સહિતના અન્ય લોકોની મિલિભગતની પ

લોલીસને જાણ થઈ પણ બહુ મોડું થઈ ગયું હતું. આ દરમિયાનમાં આરોપીઓને છટકાવવાની મળી ગઈ હતી. સીઆઈડી કાર્ડમાં બનાવટી પાસપોર્ટ વિદેશ મોકલવાના રેકેટની તપાસ શરૂ કરતા વિકાસ જયસ્વાલની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછ બાદ પોતાના પર સંકળે કસારો તેવી ગંધ આવી જતા આરોપી વિકાસ પક્ષ મકાનને લોક મારી યુ.કે. ભાગી ગયો હતો. સીઆઈડી કાર્ડમાં તપાસમાં ખુલેલી વિગતો કુરિયરમાં પાસવલ મોકલવા માટે આરોપી પાસવલ મોકલનાર તરીકે અન્ય વ્યક્તિઓના આધાર કાર્ડની ફોટો આઈડી કુરિયર કંપનીમાં રજૂ કરતો હતો.

આગામી ચૂંટણીઓને લઈને રાજકીય પક્ષોની વચનોની લહાણી રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોંગ્રેસની ફરી સત્તા લાવવા માટે ભગીરથ પ્રયાસ

ગુજરાતમાં કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના લાગુ કરાશે : રાહુલ ગાંધી

અમદાવાદ, તા. ૨૦ | ગાંધીનગર જાણે છાવણીમાં ફરવાયુ હોય તે રીતે વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા ગ્રેડ પે, પગાર વધારો, કામના કલાકો, જૂની પેન્શન યોજના સહિતના મુદ્દે આંદોલન કરવામાં આવી રહ્યું છે. આ આંદોલનમાં વિવેજ કમ્યુટર ઓપરેટરો પણ જોડાયા છે, જેઓ ગામે ગામમાંથી ગાંધીનગરમાં એકઠા



થઈને પોતાની માંગને વધારે મજબૂતાઈથી રજૂ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે રાહુલ ગાંધીએ પણ કર્મચારીઓના જૂની પેન્શન યોજનાને લાગુ કરવાના અવાજને ધ્યાને લીધો છે. રાહુલ ગાંધીએ આંદોલન કરીને માંગ યોજના, તેમણે આ અંગે આગળ કહ્યું છે કે, અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની

કરવાની બાંહેધરી આપી દીધી છે. રાહુલ ગાંધીએ દ્વિવ કરીને લખ્યું છે કે, જૂની પેન્શન યોજનાનો અંત લાવીને ભાજપે ધરડાઓને આત્મનિર્ભરથી નિર્ભર બનાવી દીધા. દેશને મજબૂત કરતા સરકારી કર્મચારીઓનો હક છે, જૂની પેન્શન યોજના, તેમણે આ અંગે આગળ કહ્યું છે કે, અમે રાજસ્થાન, છત્તીસગઢમાં જૂની

પેન્શન યોજના ચાલુ કરી છે. હવે ગુજરાતમાં પણ કોંગ્રેસની સરકાર આવશે તો જૂની પેન્શન યોજના ચાલુ કરવામાં આવશે. એક તરફ આમ આદમી પાર્ટી ભાજપના શાસનથી પ્રજા ત્રસ્ત થઈ ગઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોના તથા વીજળી સહિતના મુદ્દે ખુલ્લી ચર્ચાની ચેલેન્જ ફેંકી રહ્યા છે.

જે.પી. નડા બે દિવસે ગુજરાત પ્રવાસે આવ્યા

ગુજરાતમાં ભાજપની સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી : જે.પી.નડા

ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડા નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં શુભારંભ કરાવેને ઇ-બાઇઝનેસ ફ્લેગ ઓફ કરાવ્યું

ગાંધીનગર, તા. ૨૦ | ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડા મંગળવારે સૌરાષ્ટ્રના પ્રવાસે હતા. અહીંથી તેમણે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. રાજકોટમાં સંબોધન કરતા જે પી નડાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. તથા આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીતનો દાવો પણ કર્યો હતો. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભલે હજુ જાહેર નથી થઈ, જો કે ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે, આ દ્રશ્યો તેનો પુરાવો છે. ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડાએ સૌરાષ્ટ્રી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ માટે સૌરાષ્ટ્ર અને એમાં પણ મોરબી તેમજ રાજકોટની પસંદગી શા માટે કરી, તો તેનો જવાબ એ છે કે મોરબી ભૂતકાળમાં પાર્ટીદાર મુખ્યમંત્રી અને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.



રોડથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી યોજાયેલા રોડ શોમાં મોરબી તેમજ રાજકોટની પસંદગી શા માટે કરી, તો તેનો જવાબ એ છે કે મોરબી ભૂતકાળમાં પાર્ટીદાર મુખ્યમંત્રી અને અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતના નેતાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

રાજકોટમાં નડાએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના મહાસંમેલનમાં હાજરી આપી, મહાયત્રી સંસદ સુધીના ૧૦ હજાર પ્રતિનિધિઓ કાર્યક્રમમાં હાજર રહ્યા. કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે રાજકોટમાં તૈયાર થઈ રહેલી એઈસને લગતા એક કિસ્સાનું વર્ણન કર્યું...

રાજકોટ બાદ નડા મોરબી પહોંચ્યા હતા, જ્યાં તેમણે ભવ્ય રોડ શો યોજ્યો, મોરબીના શનાળા અપનાવે છે, તે જોવું રહેશે.

» સિરામીક કારખાનાઓથી લોકો સંત્ર થયાં

મોરબીમાં તંત્રના પાપે આજે પણ લોકો મારફ પહેરી રાખે છે

મોરબી પાલિકા દ્વારા રોડનું સમારકામ ના થવાના કારણે મુશ્કેલીમાં વધારો

। મોરબી ।
કોરોના કાળબાદ લોકોએ સ્વેચ્છીક રીતે મારફથી મુક્તિ લઈ લીધી છે, પરંતુ રાજ્યનું એક શહેર એવું છે જ્યાં હજુ લોકો મારફ પહેરે છે. જોકે, કારણ કોરોના નથી પરંતુ મારફ પહેવાનું કારણ ધૂળ છે. મોરબીમાં સિરામીક કારખાનાઓના કારણે ઉડતી ધૂળના લીધે લોકોને મોઢે રૂમાલ બાંધીને નીકળવું પડે છે. મોરબી શહેર ધૂળમાંથી ટાઈલ્સનું ઉત્પાદન કરતું શહેર છે, પરંતુ રહેણાંક વિસ્તારમાં ઊંડતી ધૂળ લોકો માટે સુખીભત બની છે. શહેરમાં અનેક રસ્તાઓ પર ધૂળની ઉમરીઓ ઉડી રહી છે. જેનાથી વાહનચાલકો, દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો વળી ઉડતી ધૂળ આંખમાં અને મોંમા પણ જાય છે. સ્થાનિકોનું કહેવું છે કે, કોરોનાની વેકસિન તો આવી ગઈ છે પરંતુ ધૂળના કારણે બગડેલા ફેફસા સારા કરવાની વેકસિન આવી નથી. જેને કારણે લોકોને મોઢે રૂમાલ બાંધવો પડે છે. સ્થાનિકોને આ ધૂળને કારણે ફેફસાની બીમારી, શ્વાસની બીમારી, પથરી જેવા રોગોની ભીતિ છે. તો વળી તૂટેલા રોડને કારણે ડમરીઓ પણ ઉડી રહી છે. સ્થાનિકો વહેલી તકે રોડ-રસ્તાના સમારકામની માગ કરી રહ્યા છે. જેથી ધૂળમાંથી મુક્તિ મેળવી લોકો રોગના ભયથી પણ મુક્ત થાય. જેથી વહેલામાં વહેલી તકે મોરબીમાં રોડ રસ્તા સારા બનાવવામાં આવે અને શહેરને ધૂળમાંથી મુક્તિ અપાવીને ભવિષ્યમાં થતા રોગોના ભયમાંથી મુક્તિ અપાવે એવી લોકોની તંત્ર પાસે માંગણી છે.

» માનવતા મરી પરવારી । જસદણ પોલીસ સ્ટેશનમાં યુવકને પોલીસે માર મારતાં હતાશામાં સરી પડ્યો

પોલીસે માર મારતાં અપમાનિત યુવકનો આપઘાત

જયપુરી ગોસ્વામી આપઘાત કેસમાં સિવિલ હોસ્પિટલ ખાતે સમાજના ટોળા એકત્ર થયાં



। રાજકોટ ।

જસદણ ખાતે એટીએમમાં લાખોની ચોરી મામલે પોલીસે રાજકોટના યુવકને આક્ષેપ કરતાં જયપુરીએ આપઘાત કર્યોનો આક્ષેપ કરી પરિવારે મુતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ છે.

કરી લીધાનો આક્ષેપ થતા હોબાળો મચી ગયો છે. જયપુરી ગોસ્વામી એટીએમમાં રૂપિયા નાબવોનું કામ કરતો હતો. તેના સહિત-કુલ ત્રણ લોકો પાસે જ 12 ઓકડાનો કોડ હોય છે. ડિજિટલ લોક બોલી રૂ.17.33 લાખની ચોરીના બનાવમાં પોલીસે શંકાના આધારે પોલીસ સ્ટેશન બોલાવી પોલીસે ટોચેર કરતાં જયપુરીએ આપઘાત કર્યોનો આક્ષેપ કરી પરિવારે મુતદેહ સ્વીકારવા ઈન્કાર કરતા પોલીસ સિવિલ હોસ્પિટલે દોડી ગઈ છે.

સુત્રોદ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર જસદણ ખાતે માનપર ગીતાનગર રોડ પર આવેલા બેન્ક ઓફ બરોડા શાખાના એટીએમનું બોક્સ ખોલી તેમાંથી રૂ.17.33ની રોકડ ચોરી કરી ગયાની ફરિયાદ જસદણ પોલીસમાં નોંધાઈ હતી. અનેની બેંક ઓફ બરોડા શાખામાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતા પિન્નુ કુમારે ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારી બેંક શાખાની બાજુમાં બેંક ઓફ બરોડાનું એ.ટી.એમ આવેલું છે. જેમાં એ.ટી.એમ માં કેશ નાખવા વાળી એજન્સી તરીકે સીકયોર વેલ્યુ એજન્સી પાસે કોન્ટ્રાક્ટ છે અને જેમાં રાજકોટના રવિન્દ્ર ગોસ્વામી લોકેશન ઈન્ચાર્જ છે. ગત તા.15/09 ના રોજ હું બ્રાન્ચ ખાતે હાજર હતો છોકરે વાગ્યે રાજકોટ ખાતેથી કર્ટોડીયલ રવિન્દ્ર ગોસ્વામી તથા જયપુરી ગોસ્વામી બંને આવ્યા હતા અને વાત કરી કે તેઓ એ

» જામનગરને છોટા કાશી તરીકે પણ ઓળખાય છે

શનિમંદિરમાં લોકોની અતૂટ શ્રદ્ધા દર્શન માત્રથી કષ્ટોનું નિવારણ

શનિ મંદિરની 15 વર્ષ પહેલા 2008 માં કરવામાં આવી હતી

। જામનગર ।
જામનગરને છોટા કાશીનું બિરુદ આપવામાં આવ્યું છે, જેમ કાશીનાં અનેક મંદિરો છે તેવી જ રીતે જામનગરમાં નાનામોટા અનેક મંદિરો આવેલા છે, એટલું જ નહીં આ મંદિરો અતિહાસિક અને પૂજ્ય છે અને તેની સાથે અનેક માન્યતાઓ પણ જોડાયેલી છે. આ મંદિરોમાં મહાદેવ, કૃષ્ણ મંદિરો અને માતાજીના અનેક મંદિરો આવેલા છે, દરરોજ હજારોની સંખ્યામાં ભારતગામનાં ભક્તો દર્શન કરવા માટે જામનગર આવે છે. ત્યારે આ મંદિરોમાં એક એવું પણ મંદિર છે જેના દર્શન કરવાનું ભક્તો ક્યારેય ચુકતા નથી, આ મંદિર છે શનિદેવનું મંદિર જે જામનગરમાં આવેલું છે. શનિવાર અને મંગળવારે શનિદેવનાં દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો આવે છે. અહીંના પુજારીનું કહેવું છે કે જામનગરમાં નાગેશ્વરમાં આવેલા આ શનિ મંદિરની સ્થાપના 15 વર્ષ પહેલા 2008 માં કરવામાં આવી હતી, ત્યારથી લોકો અહીં દર્શન કરવા આવે છે અને મનોકામના પુર્ણ થતી હોવાનું જણાવે છે. તો અહીં ઓકળાની માળા અને તેલ પણ ચઢાવે છે. તમામ ગ્રહોમાં શનિદેવનું પાસ મહત્વ રહેલું છે. કષ્ટ નિવારવા માટે શનિની પુજાનું પાસ મહત્વ રહેલું છે. જામનગર આવો એટલે સામા કાંઈ રંગમતી નહીં કાંઈ ખોડિયાર માતાજીથી લઈને ભગવાન ભગાનાથનું મંદિર પણ આવેલું છે. તો અહીં જ શનિ દેવનું સુંદરતા મંદિર આવેલું છે.

» ટ્રેડર ઓફિસનો નક્કી સિક્કો લગાડી કૌભાંડ આચર્યું

રાજકોટમાં જંત્રીના નાણા બારોબાર સગેવગે કરી નાંખનાર બે ઝડપાયાં

બંને આરોપીઓએ ભેગા મળીને છ અરજદારના નાણાં હજમ કરી નાંખ્યાં

। રાજકોટ ।
રાજકોટ ખાતે અરજદારોની સુચીત મિલકતને રેગ્યુલરઈઝ કરવા માટે જરૂરી જંત્રીના નાણાં ચલણથી બેંકમાં જમા કરાવવાને બદલે બારોબાર ચાઉ કરી જતાં હતાં બદલામાં ચલણમાં બેંકના ખોગસ સહી, સિક્કા કરી કૌભાંડ આચરનાર મામલતદાર કચેરીમાં કોન્ટ્રાક્ટ બેંક પર નોકરી કરતા બે કમર્સીઅલ મોહન ગરીબલ (ઉ.વ. 37) અને વિવેક બનાથામ રાહોડા (ઉ.વ. 25) ને કાઈમ પ્રાન્ચે ઝડપી લીધા હતા. આ બંનેએ છ અરજદારોના નાણાં ઉચાપત કર્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી અલ્પેશ મામલતદાર કચેરી (પૂર્વ) માં કોન્ટ્રાક્ટ બેંક પર કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. બીજો આરોપી વિવેક પણ ત્યાં જ કોન્ટ્રાક્ટ બેંકથી ડ્રાઈવર છે. બંને આરોપીઓ પોતાની કચેરીમાં સુચીત મિલકતને રેગ્યુલરઈઝ કરવા માટે અરજદારો પાસેથી જંત્રી મુજબના નાણાં ચલણથી બેંકમાં ભરવા એસીઆઈમાં જતા હતા. અરજદારને બેંકની બહાર ઉભા રાખી આરોપીઓ બેંકની અંદર જઈ ચલણમાં બેંકના ખોગસ ભરવા સ્ટેમ્પ લગાડી, રકમ પોતાના ખિસ્સામાં નાખી અરજદારને ચલણ ભરાઈ ગયું છે, તેમ જણાવી દેતા હતા. ત્યારબાદ મામલતદાર કચેરીમાં ટ્રેડર ઓફિસમાં ચલણ મુજબના નાણાં ભરાઈ ગયા છે કે કેમ તેનો વેરીફિકેશન સ્વરૂપમાં વધતો કચરો પાસ કરીને નદી અને દરિયાઈ પર્વાવરણમાં એક મોટી ચિંતા અને વધતી જતી ઓટરરાષ્ટ્રીય સમસ્યા છે. અસંખ્ય અભ્યાસોએ દરિયાઈ જૈવ વિવિધતા, જીવસૃષ્ટિ, માછીમારી, માનવ સ્વાસ્થ્ય અને અર્થ વ્યવસ્થા પર તેની હાનિકારક અસરો દર્શાવી છે. ત્યારે દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે દર વર્ષે સપ્ટેમ્બરનાં ત્રીજા શનિવારે વિશ્વ કોષ્ટલકલિન અખંડિત વસ્તુ તરીકે ઉજવવામાં આવે છે. જેનું જામનગરમાં સીમા જાગરણ

» જામનગરમાં સીમા જાગરણ મંચ દ્વારા

બાલાછડી બીથ ખાતે સ્થાનિકોના સહકારથી સફાઈ અભિયાન કરાયું

650થી વધુ લોકો દ્વારા સફાઈ અભિયાનમાં ભાગ લીધો

। જામનગર ।
ભારતને 7500 કિલોમીટર જેટલા વિશાળ અને સૌથી લાંબા અને સુંદર દરિયા કિનારો હોવાનો ગર્વ છે. જોકે પ્લાસ્ટિકના સ્વરૂપમાં વધતો કચરો પાસ કરીને નદી અને દરિયાઈ પર્વાવરણમાં એક મોટી ચિંતા અને વધતી જતી ઓટરરાષ્ટ્રીય સમસ્યા છે. અસંખ્ય અભ્યાસોએ દરિયાઈ જૈવ વિવિધતા, જીવસૃષ્ટિ, માછીમારી, માનવ સ્વાસ્થ્ય અને અર્થ વ્યવસ્થા પર તેની હાનિકારક અસરો દર્શાવી છે. ત્યારે દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે દર વર્ષે સપ્ટેમ્બરનાં ત્રીજા શનિવારે વિશ્વ કોષ્ટલકલિન અખંડિત વસ્તુ તરીકે ઉજવવામાં આવે છે. જેનું જામનગરમાં સીમા જાગરણ

» કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બનેલા બનાવથી હાહાકાર

હળવદના મેરૂપર ગામે બે શિક્ષિકાનો ત્રાસ: 17 વિદ્યાર્થીનીની તબિયત લથડી

તબીયત બગડવાનું મુખ્ય કારણ ગભરાહટ અને માનસિક તણાવ હોવાનું તબીબોનું તારણ

। હળવદ ।
હળવદ તાલુકાના મેરૂપર ગામે આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વિવાદ સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીઓને બે શિક્ષિકાઓ ત્રાસ આપતી હોવાનો આક્ષેપ થયો છે. ત્રાસને કારણે 17 જેટલી વિદ્યાર્થીનીઓની તબિયત ગઈકાલે લથડતા તમામને હળવદ સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડાઈ હતી. ગભરાહટ અને માનસિક તણાવના કારણે તબિયત વિદ્યાર્થીઓની તબિયત બગડી હોવાનું તબીબોએ જણાવ્યું હતું. સમગ્ર મામલે વાલીઓએ આજે સવારે વિદ્યાલય ખાતે હોબાળો મચાવ્યો હતો. બનાવના પગલે મોરબીથી ઉચ્ચ અધિકારીઓની ટીમ મેરૂપર કસ્તુરબા ગાંધી બાલિકા શાળા ખાતે પહોંચી હતી. સમગ્ર વિવાદ મામલે તપાસ હાથ ધરી છે. કરવામાં આવ્યો છે.

» અસામાજિક તત્વો દ્વારા એસ્ટો ટર્ફને ખોદી નંખાઈ

રાજકોટમાં યુનિ.નાં હોકી મેદાનની ચકાસણી માટે દિલ્હીથી ટીમ આવશે

વાનખેડે દ્વારા રાજકોટમાં બનેલી ઘટનાથી રમતપ્રેમીઓમાં આકોષ

। રાજકોટ ।
નેશનલ ગેઈમ્સની હોકીની મેચ જ્યાં રમાવાની હતી એ સૌરાષ્ટ્ર યુનિ. નાં હોકી ગ્રાઉન્ડમાં કોઈ અવગળચડા તત્વોએ મેદાનમાં એસ્ટો ટર્ફને ખોદી નાંખ્યાની ઘટનાનાં ઘેરા પડવા રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા છે. ગુજરાતમાં નેશનલ ગેઈમ્સ જેનાં માર્ગદર્શન હેઠળ રમાવાની છે તે ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનનાં નિષ્ણાંતોની એક ટીમ રાજકોટ આવી રહી છે અને બુધવારે સવારે હોકી મેદાનની મુલાકાત લીધા બાદ રમવા અંગેનો નિર્ણય જાહેર કરશે. રાજકોટમાં હોકી અને સ્વીમીંગ બે રમતોની યજમાની માટે તડામાર તૈયારીઓ થઈ રહી હતી ત્યારે જ યુનિ. નાં હોકી ગ્રાઉન્ડને શુધ્ધવારે તા. 1૬ મીએ રાતે કોઈ તત્વોએ કચરો જેવા સાધનોની મદદથી મેદાનને નુકશાન પહોંચાડ્યાની ઘટનાથી સ્થાનિક તંત્ર અને યુનિ.ની ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરેથી આ અંગે સ્થાનિક અધિકારીઓને પણ ઠપકો આપવામાં આવ્યો હતો અને યુનિ.એ આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. રાજકોટમાં નેશનલ ગેઈમ્સ રમાવાની હોય એ શહેર માટે ગૌરવની વાત છે ત્યારે આવું હિન કૃત્ય આચરવામાં આવ્યું એનાથી આખા શહેરની પ્રતિષ્ઠા અસર પડી છે. આ મામલે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત વિભાગ અને ઓલિમ્પિક એસો.નાં પ્રતિનિધિઓ વચ્ચે ઓનલાઈન ચર્ચાઓ કરવામાં આવી ત્યારે આ ઘટનાની ગંભીર નોંધ લેવાઈ હતી. ભૂતકાળમાં મુંબઈમાં વાનખેડે ક્રિકેટ મેચ ખોદી નાખવાની ઘટના વખતે દેશભરમાં હોબાળો મચી ગયો હતો.

» જેતપુરની કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના પી.ટી. શિક્ષક વિરમ નંદાણીયા દ્વારા શિક્ષકની ગરીમાને લાંછન લગાડાયું

શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીઓ સાથે ગેરવર્તન કરતાં હોબાળો વાલીઓએ હોબાળો મચાવી સમગ્ર પોલીસ સ્ટેશનને ઘેરી લેતાં વાતાવરણ ઉગ્ર બન્યું

। જેતપુર ।
જેતપુર ખાતે આવેલી કુંભાણી મ્યુનિ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષક પોતાની ગરીમા ભૂલતાં લાંછનરૂપ ઘટના પ્રકાશમાં આવી છે. વિદ્યાર્થીનીઓ સાથે અભદ્ર વર્તન કરવાનો શિક્ષક પર ગંભીર આક્ષેપ મુકવામાં આવ્યો છે. વિદ્યાર્થીનીઓ અને વાલીઓએ સ્કૂલમાં જેઈને વ્યાપક હોબાળો મચાવ્યો હતો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક સામે પોકસો કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જેતપુરમાં પાલિકા દ્વારા સંચાલિત કુંભાણી ગર્લ્સ હાઈસ્કૂલના પી.ટી. શિક્ષક વિરમ નંદાણીયા દ્વારા શનિવારના રોજ ધોરણ ૧૧ની વિદ્યાર્થીનીઓને અપશબ્દ બોલતા વાલીઓ આજે સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે શિક્ષકનો બચાવ કરતા મામલો બગડ્યો હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક સામે અપશબ્દો આપવામાં આવ્યાં હતાં. આ મામલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આગેવાનો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું



રાજ ધોરણ ૧૧ની વિદ્યાર્થીનીઓને અપશબ્દ બોલતા વાલીઓ આજે સ્કૂલે પહોંચ્યા હતા અને વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓએ આચાર્યને રજૂઆત કરી હતી. પરંતુ આચાર્ય દ્વારા આ બાબતે શિક્ષકનો બચાવ કરતા મામલો બગડ્યો હતો અને વિદ્યાર્થીનીઓ દ્વારા શિક્ષક સામે અપશબ્દો આપવામાં આવ્યાં હતાં.

» માલધારી સમાજ દ્વારા ઉગ્ર લડતના અંદાણ

રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પાછો ખેંચાવા અંગે સસ્પેન્સ

તા.21મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં માલધારી સમાજ દૂધ નહીં આપે

। રાજકોટ ।
ગુજરાત સરકાર થોડા સમય પહેલાં ગુજરાત વિધાનસભામાં પસાર કરેલો રખડતાં ઢોર નિયંત્રણ વિધેયક પાછો ખેંચે એવી વિગતો બહાર આવી છે. જોકે ગુજરાત સરકારે આ વિશે કોઈ સ્પષ્ટતા કરી નથી.

છેલ્લા કેટલાક દિવસોથી માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ વિધેયક સામે વિરોધ કરાઈ રહ્યો છે. રવિવારે ગુજરાત માલધારી મહાપંચાયત દ્વારા જાહેર સભા પણ કરવામાં આવી હતી અને એમાં શહેરી ઢોર નિયંત્રણ કાયદાને નાબૂદ કરવા માગણી ભુલવ કરી હતી. આ ઉપરાંત ૨૧ સપ્ટેમ્બર બુધવારે સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દ્વારા એક દિવસની દૂધની હડતાળ જાહેર કરી છે. આ દિવસે માલધારીઓ ડેરીઓમાં તેમ જ ઘર-ઘરે દૂધ આપવા નહીં જાય. માલધારી સમાજ દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવી રહી છે અને એક પછી એક કાર્યક્રમ પણ જાહેર કરી રહ્યા છે ત્યારે બિનસત્તાવાર રીતે એવી વિગત બહાર આવી છે કે રાજ્યપાલે આ વિધેયક પુનઃ વિચારણા માટે પાછો ખેંચ્યો છે. ગુજરાતમાં આગામી દિવસોમાં મળનારી વિધાનસભામાં આ વિધેયક ગુજરાત સરકાર પાછો ખેંચશે એવું ચર્ચાઈ રહ્યું છે.



દ્વારા ઉગ્ર લડત ચલાવવામાં આવી રહી છે અને એક પછી એક કાર્યક્રમ પણ જાહેર કરી રહ્યા છે ત્યારે બિનસત્તાવાર રીતે એવી વિગત બહાર આવી છે કે રાજ્યપાલે આ વિધેયક પુનઃ વિચારણા માટે પાછો ખેંચ્યો છે.

» જમીનને જુની શરતમાં ફેરવવાનો જે હુકમ આરોપીઓએ રજુ કર્યો હતો તે અંગે મોરબી સેવા સદનમાં જઈ તપાસ કરતા નક્કી હોવાનું જાણવા મળ્યું

મોરબી SDM નો નક્કી હુકમ રજૂ કરી એક કરોડની ઠગાઈ

» જમીન જુની શરતમાં ફેરવાઈ ગઈ છે દસ્તાવેજ કરી આપશે તેમ અન્ય પાર્ટીને જણાવી એસડીએમનો નક્કી હુકમ બતાવ્યો હતો

। રાજકોટ ।
ટંકારાના સરાયા ગામે આવેલી જમીનનો એક પાર્ટી સાથે સોદો કર્યા બાદ અન્ય વ્યક્તિને વેચવાની પેરવી કરવા ઉપરાંત મોરબી એસડીએમનો ખોટો હુકમ રજૂ કરવા અંગે સરાયા ગામના જસવંતસિંહ રામસિંહ સરાન અને તેના પુત્ર રણજીતસિંહ વિરૂધ્ધ બી-ડીવીલન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

રણજીતનગર શેરી નં- 29 ઉપરાંત સાધુ વાસવાણી રોડ પરના પ્લોટીયમ હાઈટ્સ બિલ્ડિંગમાં રહેતા રસીલાબેન પાંચાભાઈ ગોવટીયા (ઉ.વ. 45) એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિને માલીયાસણમાં મારૂતી ફ્યુલ નામથી પેટ્રોલ વપ છે. 2014 ની સાલમાં સરાયા ગામે રેવન્યુ સર્વે નં- 21 ની જમીન કે જે અવિભાજ્ય શરતની ખેડવણ જમીન હતી તે ખેડુત ખાતેદાર જસવંતસિંહ પાસેથી ખાતેના પોતાના ઘરે કર્યું હતું. બદલામાં બંનેએ અવેજની પહોંચ અને સોંપણીનો કરાર પણ લખી આપ્યો હતો. 2017 ની સાલમાં જસવંતસિંહ જમીનનું સાટાખત એટલે કે વેંચાણ કરાર પણ કરી આપ્યું હતું. ત્યારબાદ અવાર-નવાર તેના તરફથી દસ્તાવેજ કરી આપવા માટે કહેવાતું હતું પરંતુ તેને ટાળતા રહી દિવસો પસાર કર્યા હતા.

દોઢેક વર્ષ પહેલા જસવંતસિંહ અને તેનો પુત્ર તેના રણજીતનગર સ્થિત ઘરે આવ્યા હતા. આવીને કહ્યું કે હવે તેમની જમીન જુની શરતમાં ફેરવાઈ ગઈ છે. જેથી તેનો દસ્તાવેજ કરી આપશે, તેમ કહી મોરબી એસડીએમનો હુકમ પણ બતાવ્યો હતો. તે વખતે બંનેને રૂ. 8 લાખ આપ્યા હતા. છ માસ પહેલા જસવંતસિંહનું અવસાન થયું હતું. ત્યારબાદ તેનો પુત્ર રણજીતસિંહને અવાર-નવાર દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. પરંતુ તે થોડા દિવસનું કહી ટાઈમ પાસ કરતો હતો.

આખરે તેના પતિએ જમીનને જુની શરતમાં ફેરવવાનો જે હુકમ આરોપીઓએ રજૂ કર્યો હતો તે અંગે મોરબી સેવા સદનમાં જઈ તપાસ કરતા નક્કી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે રણજીતસિંહનો મોબાઈલ પર સંપર્ક કરતા કોલ રીસીવ કર્યો નહતો. ગામમાંથી પણ મળી આવ્યો નહતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ બીજા કોઈને જમીન વેચવાની પેરવીમાં છે. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.

એક કરોડ પાંચ લાખમાં સોદો થયો હતો. આ કરાર વખતે રૂ. 15 લાખની કિંમતની એસયુવી કાર, મોરબી રોડ પરનું રૂ. 35 લાખની કિંમતનું મકાન, રૂ. 8 લાખ રોડડા, રૂ. 4 લાખ ચેકશી મળી કુલ રૂ. 62 લાખનું પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટ જસવંતસિંહ અને તેના પુત્રને રણજીતનગર ખાતેના પોતાના ઘરે કર્યું હતું. બદલામાં બંનેએ અવેજની પહોંચ અને સોંપણીનો કરાર પણ લખી આપ્યો હતો. 2017 ની સાલમાં જસવંતસિંહ જમીનનું સાટાખત એટલે કે વેંચાણ કરાર પણ કરી આપ્યું હતું. ત્યારબાદ અવાર-નવાર તેના તરફથી દસ્તાવેજ કરી આપવા માટે કહેવાતું હતું પરંતુ તેને ટાળતા રહી દિવસો પસાર કર્યા હતા.

દોઢેક વર્ષ પહેલા જસવંતસિંહ અને તેનો પુત્ર તેના રણજીતનગર સ્થિત ઘરે આવ્યા હતા. આવીને કહ્યું કે હવે તેમની જમીન જુની શરતમાં ફેરવાઈ ગઈ છે. જેથી તેનો દસ્તાવેજ કરી આપશે, તેમ કહી મોરબી એસડીએમનો હુકમ પણ બતાવ્યો હતો. તે વખતે બંનેને રૂ. 8 લાખ આપ્યા હતા. છ માસ પહેલા જસવંતસિંહનું અવસાન થયું હતું. ત્યારબાદ તેનો પુત્ર રણજીતસિંહને અવાર-નવાર દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. પરંતુ તે થોડા દિવસનું કહી ટાઈમ પાસ કરતો હતો.

આખરે તેના પતિએ જમીનને જુની શરતમાં ફેરવવાનો જે હુકમ આરોપીઓએ રજૂ કર્યો હતો તે અંગે મોરબી સેવા સદનમાં જઈ તપાસ કરતા નક્કી હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે રણજીતસિંહનો મોબાઈલ પર સંપર્ક કરતા કોલ રીસીવ કર્યો નહતો. ગામમાંથી પણ મળી આવ્યો નહતો. વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ બીજા કોઈને જમીન વેચવાની પેરવીમાં છે. જેથી આખરે ફરિયાદ નોંધાવી હતી.



બરીદવાનું નક્કી કર્યું હતું. આ માટે તેના પતિ કમલેશ જસવંતસિંહ અને તેના પુત્ર રણજીતસિંહ સાથે રૂ.100 ના સ્ટેમ્પ પેપર ઉપર સમજૂતી કરાર કર્યા હતા. જેમાં રૂ. 35 લાખની કિંમતનું મકાન, રૂ. 8 લાખ રોડડા, રૂ. 4 લાખ ચેકશી મળી કુલ રૂ. 62 લાખનું પેમેન્ટ કર્યું હતું. આ પેમેન્ટ જસવંતસિંહ અને તેના પુત્રને રણજીતનગર ખાતેના પોતાના ઘરે કર્યું હતું. બદલામાં બંનેએ અવેજની પહોંચ અને સોંપણીનો કરાર પણ લખી આપ્યો હતો. 2017 ની સાલમાં જસવંતસિંહ જમીનનું સાટાખત એટલે કે વેંચાણ કરાર પણ કરી આપ્યું હતું. ત્યારબાદ અવાર-નવાર તેના તરફથી દસ્તાવેજ કરી આપવા માટે કહેવાતું હતું પરંતુ તેને ટાળતા રહી દિવસો પસાર કર્યા હતા.

» રામના નામે પથ્થર તર્યા, હવે નાણા કમાવવાનો તંત્રનો ઇરાદો

રાજકોટનો 'રામવન' વિવાદનું કેન્દ્ર ખાનગી સંસ્થાને સોંપવાની હિલચાલ!

રામવનનું સંચાલન કરવા મનપા પાસે 4000 નો પર્યાપ્ત સ્ટાફ છતાં પણ માનિતાને લાભ કરવાવા ચાલતી ગોઠવણ

। રાજકોટ ।
રામના નામે પથ્થર તરી ગયાં છે હવે આપણને પણ કમાણી કરી આપશે તેમ માની રાજકોટના વાતાવરણીક ચેમ્બરમાં બેસેલાઓએ રાજકોટના આજી ડેમના ડાઉન સ્ટ્રીમમાં કિસાન ગૌશાળા પાસે 47 એકર જમીનમાં રૂ. 18 કરોડનું પ્રજાની તિજોરીમાંથી આંધણ કરીને બનેલા રામવનમાં રામની પ્રતિમાના દર્શન માટે એન્ટ્રી ફી કીક્યા પછી હવે આવક રળવા માટે તે ખાનગી સંસ્થાને સોંપી દેવાની હિલચાલ શરૂ થઈ હોવાનું જાણવા મળેલ છે.

રાજકોટ મહાનગર પાલિકા પાસે 4000 નો પર્યાપ્ત સ્ટાફ વર્ષે દહોડે રૂ. 350 કરોડથી વધુ પગાર, ભથ્થા અપાય છે. આ સ્ટાફની માંગણીઓ તાજેતરમાં સંતોષાઈ છે અને અન્ય નાણાકીય લાભો અપાય છે. આવા નિકાસકાર્યોના સંચાલન ખર્ચ કાઢવા તડગો ટેક્સ મનપાને લોકો યુક્ત છે તે ઓછો પડતા એન્ટ્રી ફીની લાભો રૂ.ની આવક પણ થાય છે. ટી.પી. સ્ક્રીમોમાં અજબો રૂ.ની જમીનો વેચ

તંત્રી લેખ.

જવાનો સામેના પડકારો

જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ મોટા પાયે કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટના પરિણામસ્વરૂપે એકપછી એક મોટી સફળતા હાથ લાગી રહી છે. તમામ કુખ્યાત ત્રાસવાદી સંગઠનોની કમર તુટી ચુકી છે. હવે ત્રાસવાદીઓ તેમના અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે. જમ્મુકાશ્મીરમાં સક્રિય ત્રાસવાદી સંગઠન હિઝબુલ મુજાહીદીન અને લશ્કરે તોયબાના તમામ ટોપના ત્રાસવાદીઓ કુદરતી મૃત્યુ પામ્યા છે. આ ઓપરેશન હઠળ માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક પદાર્થ કબજે કરવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે ૨૦૦થી વધારે ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. આ વર્ષે પણ મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ માર્યા ગયા છે. જેમાં પોસ્ટર બોય ટાઈગરનો પણ સમાવેશ થાય છે. બુરહાન વાની ગેંગનો સફાઈ કરવામાં આવ્યો છે. જો કે જમ્મુ કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા અને લોકોમાં આત્મવિશ્વાસ ભરવા માટે અનેક પગલાની જરૂર છે. સામાન્ય લોકો સુરક્ષા દળો અને સેનાની પૂરતી મદદ કરે તે જરૂરી છે. સ્થાનિક ત્રાસવાદીઓને રક્ષણ અને આશ્રય આપવાના બદલે તેમના સંબંધમાં ગુમ માહિતી સુરક્ષા દળોને માહિતી આપે તે જરૂર છે. ત્રાસવાદ સામેની લડાઈમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા નાગરિકોની રહે છે. જો તમામ સત્કર્મ અને સાહસી તરીકે રહેશે તો ત્રાસવાદને પગ ફેલાવવાની તક મળશે નહીં. દુનિયાની તમામ સરકાર, નેતા, ત્રાસવાદની સામે એક થઈ રહ્યા છે. એક થઈને જ ત્રાસવાદનો અંત લાવી શકાય છે. લોકો હુમલા બાદ નારાજગી પ્રગટ કરવા માટે આગળ આવે છે તેને ત્રાસવાદની ઠાર તો કહી શકાય છે પરંતુ ત્રાસવાદનો ખાતમો બાકી છે. આના માટે સમગ્ર માનવતા એક થાય તે જરૂરી છે. ત્રાસવાદને જીવિત રાખનાર, તેમને મદદ કરનાર. તેમને આશ્રય આપનાર દેશોની સામે પણ પગલા લેવા પડશે. સ્વીપર સેલને નષ્ટ કરવાની દિશામાં પગલા લેવા પડશે. ત્રાસવાદને મદદ કરનાર કોઈ પણ વ્યક્તિ, સંગઠન અથવા તો દેશ કેમ ન રહે તેની સામે સંયુક્ત યુદ્ધ છેડી દેવાની જરૂર છે. જો આવું કરવામાં નહીં આવે તો કઠોર પ્રતિક્રિયા, થવા તો લશ્કરી કાર્યવાહીથી ત્રાસવાદીઓ થોડાક દિવસ તો શાંત રહી શકે છે પરંતુ ફરી કોઈને કોઈ જગ્યાએ હુમલો કરીને રક્તપાત સર્જી દેશે. ભારત, અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન ત્રાસવાદીઓના હિટલિસ્ટમાં રહ્યા છે. તેમને દુનિયાના અન્ય દેશોની સાથે મળીને પોતાની ગુમચર વ્યવસ્થાને સુધારી દેવા, સુરક્ષા દળોને આધુનિક કરવા અને ત્રાસવાદી સંગઠન પર કાર્યવાહી ની યોજના બનાવવી પડશે. જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદી હુમલાની વાત હવે સામાન્ય બની ચુકી છે. ત્રાસવાદી હુમલોનો બનાવ જે કોઈ પણ હોય પરંતુ મોટો પ્રશ્ન એ થાય કે તે હુમલાને અર્થ મળે તે હોય થઈએ છીએ. આ અમારી નબળાઈ છે કે આવી ત્રાસવાદી ઘટનાને હાથ પડતી વેળા અમે ત્રાસવાદીઓને જીવિત પકડી પાડવાના પ્રયાસ કરતા નથી. જેથી કેટલીક નક્કર વિગત હાથ લાગતી નથી. હવે ત્રાસવાદીઓ સામે ઓપરેશન ઓલઆઉટ અસરકારક તબક્કામાં છે.

થોડું હટકે...
બેકિંગ ક્ષેત્રે કેરિયર
બનાવવા તક છે

બેકિંગના ક્ષેત્રમાં કેરિયર બનાવવા માટેની ઈચ્છા ધરાવનાર યુવાનો માટે પણ કેટલીક સુવર્ણ તક રહેલી છે. તેમની સામે કેટલાક વિકલ્પ રહેલા છે. તેમાંથી એક વિકલ્પ લોન ઓફિસર બનીને લોકોના સપનાને પૂર્ણ કરવા માટેનો પથ છે. લોન ઓફિસર બનીને કેરિયરને ઉજળી બનાવી શકાય છે. વાત હોમ લોનની હોય કે પછી બિઝનેસ લોનની હોય કે પછી પરિવહન લોનની હોય તેમાં લોન ઓફિસરની ભૂમિકા ચાવીરૂપ રહે છે. બેંકો અને ગ્રાહકો વચ્ચે લોન ઓફિસર એક સેતુની જેમ કામ કરે છે. દરેક વ્યક્તિનું એક સપન હોય છે કે તે પોતાની લાઈફમાં પોતાના પરિવાર માટે એક ઘર ખરીદીને આગળ વધે. પરંતુ એક મધ્યમવર્ગીય પરિવારની વ્યક્તિ માટે ઘર લેવાનું સપન જલદી પૂર્ણ થતું નથી. તેની એટલી જવાબદારી પહેલાથી જ હોય છે કે તે આ દિશામાં વધારે આગળ વધવાની હિંમત કરી શકતી નથી. એક કાર ખરીદી શકે તેવી પણ ઈચ્છા હોય છે પરંતુ આ સપના પૂર્ણ કરવાની બાબત એટલી સરળ નથી. મધ્યમ વર્ગની વ્યક્તિની કોઈ પણ પ્રકારની લોન લેવાની ઈચ્છાને પૂર્ણ કરવાનું કામ જ લોન ઓફિસર કરે છે. તેને લોન આપવામાં લોન ઓફિસર જ મદદ કરે છે. દેશમાં બેકિંગ સુવિધાની માંગ સતત વધી રહી છે. વધતી જતી માંગના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં આ ક્ષેત્રમાં નોકરી માટેની શક્યતા રેકોર્ડ ગતિથી વધી ગઈ છે. લોન ઓફિસર બેંકના ગ્રાહકો અને બીજા લોનની અરજી કરનાર લોકો માટે મદદ તરીકેની કામગીરી અદા કરે છે. લોન ઓફિસર વ્યક્તિને હોમ, કાર, એજ્યુકેશન અને બિઝનેસ તેમજ પરિવહન લોન આપવામાં મદદ કરે છે. તે ગ્રાહકો માટે યોગ્ય લોન નક્કી કરવામાં મદદ કરે છે. તેમને જુદી જુદી જરૂરિયાતો અને શરતોના સંબંધમાં માહિતી આપે છે. તે વ્યક્તિની કેડિટ હિસ્ટ્રી, કોર્પોરેટ નાણાકીય લેવડેડવડ અને અન્ય નાણાકીય જાણકારી એકત્રિત કરે છે. તે તમામ દસ્તાવેજ મેળવી લીધા બાદ લોનના પાસા પર અભ્યાસ કરે છે. લોનના એગ્રીમેન્ટ્સની સમીક્ષા કરે છે. પેમેન્ટ શેડ્યુલની ગણતરી કરે છે. ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે નવી લોનની માહિતી પણ એકત્રિત કરે છે. લોન ઓફિસર આધુનિક સમયમાં માગ ધરાવતા ઓફિસર તરીકે છે. કોર્સ દરમિયાન વિદ્યાર્થીને તમામ પ્રકારની પ્રેક્ટિકલ જાણકારી આપવામાં આવે છે. જેમ કે અલગ અલગ પ્રકારના લોન પર વ્યાજ દર ચુકવવાની રીતે અંગે માહિતી આપવામાં આવે છે. લોનના ઈન્સ્ટોલમેન્ટ્સ કઈ રીતે નક્કી કરવામાં આવે છે તે અંગે માહિતી આપવામાં આવે છે. બેંકના તમામ સેક્ટર સંબંધમાં તાલીમ આપવામાં આવે છે. બેંકના કામ કરવાના તરીકા અંગે પણ જાણ કરવામાં આવે છે. લોન ઓફિસર બનાવવા માટે કેટલીક યોગ્યતા પહેલાથી જ હોવી જરૂરી હોય છે. સ્નાતક અથવા તો કોઈ પણ સ્ટ્રીમમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ કિંગ અને ફાયનાન્સના કોર્સ કરી શકે છે.



આજકાલ
લેખક : દીપક જગતાપ

અભ્યાસમરની બીમારીમાં યાદશક્તિ અને વિચારવાની ક્ષમતા ખતમ થઈ જાય છે

આજે ૨૧ સપ્ટેમ્બર એટલે વિશ્વ અભ્યાસમર દિવસ છે ઉંમર વધવાની સાથે જ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરને નિશાન બનાવવાનું શરૂ કરી દે છે ત્યારે અભ્યાસમર પણ તેમાંથી એક બીમારી છે

વર્ષ ૨૦૫૦ સુધીમાં ચિત્ત ભ્રમ સાથે જીવતા વ્યક્તિઓની સંખ્યા ત્રણ ગણી થઈને ૧૫.૨ કરોડ થવાનો અંદાજ છે

એક દિવસ મારા પત્રકાર મિત્રને ઘરે વડોદરા મળવાગયો હતો ત્યારે ડ્રોઈંગરૂમમાં એમના પિતાજીને આરામ કરતા જોયેલા. મેં એમને નમસ્કે કર્યા. બપોર પણ પૂછી. પણ મારા મિત્રએ મને જણાવ્યું કે એમને અલ્ઝાઈમરની બીમારી છે. એમાં એમને યાદ રહેતું નથી કે કોઈને ઓળખતા નથી. ત્યારે મને થોડો આંચકો લાગેલો.એકદમ તંદુરસ્ત વ્યક્તિ શારીરિક રીતે ખૂબ સારા હોય પણ યાદ શક્તિજ ન હોય, કશું યાદ જ આવતું ન હોય કે આપણા જ સ્વજનોને ઓળખી ન શકતા હોય ત્યારે કેટલું દુ:ખ થતું હશે.ત્યારે મને થયું કે ભૂલી જવાની બિમારી ખરેખર કેટલી દુ:ખદ હોય છે.



તેમાંથી દૈ તટ લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોના હશે.ચિત્ત ભ્રમને કારણે દેશ ઉપર દર વર્ષે એક ટ્રિલિયન અમેરિકન ડોલરનો આર્થિક બોજ પડે છે, જે ૨૬મ વર્ષે ૨૦૫૦ સુધીમાં મહાબળી થશે. આજે ૨૧ સપ્ટેમ્બર એટલે વિશ્વ અલ્ઝાઈમર દિવસ છે.ઉંમર વધવાની સાથે જ તમામ પ્રકારની બીમારીઓ આપણા શરીરને નિશાન બનાવવાનું શરૂ કરી દે છે. ત્યારે અલ્ઝાઈમર પણ તેમાંથી એક બીમારી છે. આ વૃદ્ધ લોકોમાં જોવા મળે છે. ઉંમર વધવાની સાથે-સાથે યાદ કરવાની ક્ષમતા ઓછી થતી રહે છે અને વાતો ભૂલી જવાય વિશ્વભરમાં લાખો લોકો આ રોગ થી પીડાય રહ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. વિશ્વમાં ૫ કરોડથી વધુ લોકોને ચિત્ત ભ્રમ સાથે જીવે છે.વિશ્વમાં દર ત્રણ સેકન્ડે કોઈને કોઈ વ્યક્તિ ચિત્ત ભ્રમનો શિકાર બને છે.વર્ષ ૨૦૫૦ સુધીમાં ચિત્ત ભ્રમ સાથે જીવતા વ્યક્તિઓની સંખ્યા ત્રણ ગણી થઈને ૧૫.૨ કરોડ થવાનો અંદાજ છે.

વર્ષ ૧૯૦૬માં જર્મનીના ફિઝિશિયન ડૉ.એલોઈસ અલ્ઝાઈમરે સૌપ્રથમવાર સ્મરણશક્તિમાં મોટા પ્રમાણમાં ઘટાડો અને મગજમાં અતિ સૂક્ષ્મ ફેરફારો ધરાવતી આ વિલક્ષણ બીમારી વિશે જણાવ્યું હતું. બીમારીના શોધકર્તા ડૉ.અલ્ઝાઈમરના નામ ઉપરથી હવે આ બીમારીને આપણે અલ્ઝાઈમર્સ તરીકે ઓળખીએ છીએ. ચિત્તભ્રમ માટે વૈશ્વિક સ્તરની કાર્યયોજનાને, ૨૦૧૭માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબલ્યુએચઓ) એ વર્ષ ૨૦૧૭થી ૨૦૨૫ દરમિયાન જાહેર સ્વાસ્થ્યના પ્રતિસાદ ઉપર વૈશ્વિક કાર્યયોજના અમલમાં મૂકી. વૈશ્વિક કાર્યયોજના માટે ડબલ્યુએચઓના તમામ ૧૯૪ સભ્ય દેશો સાત ક્ષેત્રે પગલાં લેવા માટે વચનબદ્ધ થયા. જાહેર સ્વાસ્થ્યમાં ચિત્ત ભ્રમને પ્રાથમિકતા આપવી.ચિત્ત ભ્રમ વિશે જાગૃતિ ફેલાવવીચિત્ત ભ્રમની બીમારી માટેનાં જોખમ ઘટાડવાનિદાનની સવલતો સુગમ કરવીસારવાર અને સંભાળ લેવીદેખભાળ કરનારાઓને મદદરૂપ થવુંમાહિતી એકત્ર કરવી અને સંશોધન કરવાં તેમાં પ્રત્યેક વિસ્તાર માટે લક્ષ્યાંકો નક્કી કરાયાં છે, જેને દરેક દેશની સરકારોએ વર્ષ ૨૦૨૫ સુધીમાં હાંસલ કરવાનાં છે. જો કે, એડિઆઈના અહેવાલમાં જણાવ્યા મુજબ, પડકાર ઘણો મોટો છે અને પ્રતિસાદ અત્યંત ધીમો છે.અલ્ઝાઈમર્સની બીમારી વિશે હકીકતો અલ્ઝાઈમર્સની બીમારી વિશેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. મગજમાં ચોક્કસ જટિલ રચનાઓ થતાં આ બીમારી જોવા મળે છે. વિશ્વના દર ત્રણમાંથી બે વ્યક્તિઓ માને છે



સરહદી ખેંચતા બાદ હિન્દ મહાસાગરમાં ભારત પ્રભાવ વધારશે...

ચીનની તમામ નાપાક હરકતો પર નજર રાખવામાં આવી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડાક સમય પહેલા આફ્રિકી દેશોની યાત્રા કરી હતી મોદી મોજામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાની યાત્રા પણ કરી છે

હિન્દ મહાસાગરમાં ડ્રેગનને જવાબ

મોજામ્બિક, કેન્યા અને તાન્ઝાનિયાની સાથે સંરક્ષણ કરાર કરવામાં આવ્યા છે : મોજામ્બિકમાં ભારત બંદરને વિકસિત કરવા તૈયાર



રહી છે. મોદીએ મોજામ્બિક પહોંચીને કેટલાક ઐતિહાસિક નિર્ણય કર્યા હતા. હાથી, મોદી મોજામ્બિક, દક્ષિણ આફ્રિકા, તાન્ઝાનિયા અને કેન્યાની યાત્રા પણ કરી છે. હકીકતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિદેશ નિતીમાં ખુબ વધારે સક્રિયતા જોવા મળી રહી છે. ભારતના સંબંધ આફ્રિકા સાથે સાંસ્કૃતિ, ઐતિહાસિક અને પરંપરાગત રહ્યા છે. આ સંબંધોને વધારે મજબુત કરવાની દિશામાં સતત પહેલ કરવામાં આવી

સમજૂતી કઠોળ માટે પણ કરવામાં આવી હતી. આ સમજૂતી ઉપયોગી સાબિત થઈ શકે છે. કઠોળના મામલે ભારત લોખા સમયથી અન્ય દેશ પર અથવા તો આયાત પર આધારિત છે. વધતી જતી માંગ અને આયાત પર નિર્ભરતાને ઘટાડી દેવા માટે ભારત હવે મોજામ્બિકમાં જમીન ખરીદનાર છે. ત્યાંજ કઠોળનું ઉત્પાદન કરવામાં આવનાર છે. ત્યારબાદ કઠોળની ત્યાંથી નિકાસ કરવામાં આવનાર છે. આના કારણે કઠોળના ભાવમાં ઘટાડો તો થશે સાથે સાથે સ્થાનિક લોકોને રોજગારી પણ મળનાર છે. ભારતમાં તેની કિંમતને અંકુશમાં લેવામાં પણ મદદ મળી શકશે. કરવામાં આવી છે. તેનો સીધો લાભ તો મોજામ્બિકમાં મુડીરોકાણ કરનાર દેશોને મળનાર છે. સાથે સાથે અમને પણ આનો સીધો ફાયદો થનાર છે. આયાત અને નિકાસની દ્રષ્ટિએ આ બંદર ઉપયોગી સાબિત થઈ શકે છે. બંદરને વિકસિત કરવાની બાબતથી મોજામ્બિક સહિત અન્ય દેશોને ફાયદો થનાર છે. આના કારણે હિન્દ મહાસાગરમાં ભારતના પ્રભાવને વધારી દેવામાં પણ મદદ મળી રહી છે. ભારત હંમેશા આ બાબતને લઈને ચિંતિત રહે છે કે ચીનની સબમરીન ક્યારેય પાકિસ્તાનમાં તો ક્યારેય શ્રીલંકાના બંદર જાઈને રોકાય છે. આવી સ્થિતિમાં આમાં બ્રેક મુકાશે. આવી સ્થિતિમાં દરિયામાં બાજ નજર રાખવામાં મદદ મળશે. સરળ ભાષામાં કહેવામાં આવે તો ભારતને હિન્દ મહાસાગરમાં પોતાની સ્થિતિને મજબુત કરવા અને હાજરી વધારી દેવાની શાનદાર તક મળી ગઈ છે. હિન્દ મહાસાગરમાં ડ્રેગનને પરોક્ષ જવાબ આપવા માટે મોદીએ કમર કસી લીધી છે. ભારત બંદર વિકસિત કરવા છે. બેંદરની વિકસિત કરવા માટે સમજૂતી

સુરક્ષાના નામ પર વિનાશને આમંત્રણ

વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષથી સાબિતી મળી રહી છે : વિશ્વના દેશો વચ્ચે સ્પર્ધા વચ્ચે ઘણી બેદરકારી રાખી રહ્યા છે જે જોખમી

વિશ્વના દેશોમાં સુરક્ષા અને વિકાસના નામ પર હથિયારોને લઈને ગળા કાપ સ્પર્ધા ચાલી રહી છે આની સાથે જ પૃથ્વી પર કયામતનું કાઉન્ટ ડાઉન પણ ચાલી રહ્યું છે. આ વાત કોઈ અન્ય સામાન્ય લોકો નહીં બલકે વિશ્વના ટોચના વૈજ્ઞાનિક કબુલી ચુક્યા છે. કેટલાક વૈજ્ઞાનિકો થોડાક સમય પહેલા આ અંગેની વાત કરીને તમામને સાવધાન કરવાના પ્રયાસ કર્યા હતા. ગ્લોબલ વોર્મિંગ, જેનેટિકલી એન્જિનિયર્ડ વાયરસ અને ન્યુક્લિયર વોરના કારણે પૃથ્વીના અસ્તિત્વ સામે સંકટ ઉભું થઈ ગયું છે તેવા સંકેત વૈજ્ઞાનિકોએ આપ્યા હતા. વિજ્ઞાનની હાલમાં જે રીતે પ્રગટિ થઈ રહી છે તેના કારણે ખતરા વધી રહ્યા છે. વિજ્ઞાનની પ્રગતિના નકારાત્મક પક્ષ પર આજે અને આંખો બંધ કરી ચુક્યા છીએ. ખતરાની ઘંટી સમાન છે. અમને સાવધાન થઈ જવાની જરૂર છે. આવનાર પેઢીઓના ભવિષ્ય માટે હજુ ઘણા પગલા લેવાની જરૂર છે. વિકાસ અને સુરક્ષાના નામ અને વિનાશને આમંત્રણ આપી રહ્યા છીએ. સુરક્ષાની ચિંતામાં અને અમારા વિનાશના જ સામાન ભેગા કરી રહ્યા છીએ. જેથી

એક વાત તો નક્કી છે કે આગામી ૧૦૦ અથવા તો એક હજાર વર્ષમાં પૃથ્વી પર વિનાશનું તાંડવ થશે જ. હોલિવુડની ફિલ્મોમાં જ નહીં અરબલની લાઈફમાં પણ જેનેચિકલી એન્જિનિયર્ડ વાયરસના પ્રકોપને અમે જોઈ ચુક્યા છીએ. ઈબોલા વાયરસના કારણે અમે આફ્રિકામાં મોતના તાંડવને નિહાળી ચુક્યા છીએ. વર્ષ ૨૦૧૪-૧૫માં ઈબોલા વાયરસના ફેલાવાના કારણે ભારે મુશ્કેલી સર્જઈ હતી. ભારે જહેમત ઉઠાવ્યા બાદ તેને અંતે મહા બિમારી બની જવાથી રોકવામાં સફળતા મળી હતી. છતાં હજારો લોકોને જાન ગુમાવી દેવાની ફરજ પડી હતી. જેનેટિકલી રીતે એન્જિનિયર્ડ વાયરસ આના કરતા પણ વધારે તબાહી મચાવી શકે છે. કેટલાક દેશો પોતાની સુરક્ષાના નામ એવા જેવિક હથિયારો જમા કરી રહ્યા છે જેમાં આ પ્રકારના યાતક વાયરસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આનો ઉપયોગ તબાહી સર્જી શકે છે. અમે દરરોજ સામાન્ય રીતે



તેંડલકરે 12 વર્ષ અગાઉ બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો, હવે ભેટમાં મળ્યો બોલ



લોક પત્રિકા | નવી દિલ્હી

હાન બેટ્સમેન સચિન તેંડલકરે 12 વર્ષ અગાઉ ગ્વાલિયરમાં ઓતરરાષ્ટ્રીય વન-ડે ઈતિહાસમાં જે બોલથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી, તે બોલ તેમને ઈન્દોરમાં ભેટ તરીકે આપવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશન (MPCA) ના એક અધિકારીએ સોમવારના રોજ આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે, તેંડલકર હાલમાં 'રોડ સેફ્ટી વર્લ્ડ સીરિઝ ટૂર્નામેન્ટ-1'ના 20 મેચોના અનુસંધાને ઈન્દોરમાં છે. આ ઝડપી ગતિનું કોર્મટ ધરાવતી આ સ્પર્ધામાં પૂર્વ ભૂતપૂર્વ ઓતરરાષ્ટ્રીય ક્રિકેટરોથી સજ્જ વિવિધ દેશોની ટીમો વચ્ચે મેચ રમાઈ રહી છે. તેમાં તેંડલકર 'ઈન્ડિયા લિજેન્ડ્સ'નું નેતૃત્વ કરી રહ્યા છે. MPCA ના મુખ્ય કમ્યુનિટી સમંદર સિંહ

ચોહાણે જણાવ્યું હતું કે, તેંડલકર પ્રેક્ટિસ માટે રવિવારના રોજ ઈન્દોરના હોલકર સ્ટેડિયમ પહોંચ્યા હતા. ચોહાણ તેમની પાસે ગ્વાલિયરમાં બનાવેલ સદીના રેકોર્ડ સાથે જોડાયેલ બોલ લઈને ગયા અને તેની ઉપર ઓટોગ્રાફ આપવાની વિનંતી કરી હતી. ચોહાણે કહ્યું હતું કે, 'તેંડલકર આ બોલ જોતા જ ઉત્સાહિત થઈ ગયા હતા. તેમણે મને પુછ્યું હતું કે, શું આ બોલ તમે મને ભેટમાં આપી શકો છો? હું તરત જ સંમત થઈ ગયો હતો કારણ કે આ મારા માટે સોબાગ્યની વાત હતી. હવે આ બોલ તેના સાચા માલિક પાસે પહોંચી ગઈ છે.'

ચોહાણે જણાવ્યું હતું કે, ગ્વાલિયરમાં 12 વર્ષ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલ વન-ડે મેચ પૂર્ણ થયા બાદ તેમણે તેંડલકરની બેવડી સદીના રેકોર્ડ સાથે જોડાયેલ બોલને યાદગારના ભાગરૂપે સાચવવાની મૂકી દીધી હતી. પિય તેયાર કરવામાં 4 દાયકાથી વધુનો અનુભવ ધરાવતા કમ્યુનિટી ચોહાણે જણાવ્યું હતું કે, ગ્વાલિયરના કેપ્ટન રુપસિંહ સ્ટેડિયમમાં તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી વિષ્ય ઉપર તેંડલકરે આ રેકોર્ડ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્વાલિયરમાં 24 ફેબ્રુઆરી 2010માં દક્ષિણ આફ્રિકાની સામેની વન-ડે મેચમાં તેંડલકરે 147 બોલ સામે 25 ફોર અને 3 સિક્સ ફટકારીને 200 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઓતરરાષ્ટ્રીય ક્રિકેટના આ ફોર્મેટમાં કોઈ પણ પ્લેયર દ્વારા બેવડી સદી ફટકારવાનો પહેલો પ્રસંગ હતો. આ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે 153 રનના વિશાળ માર્જિનથી જીત મેળવી હતી. આ મેચમાં તેંડલકરને 'લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.

નવા નિયમોથી રમાશે T20 વર્લ્ડ કપ, માંકડિંગ હવે રનઆઉટ તરીકે ગણાશે

લોક પત્રિકા | નવી દિલ્હી



ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હવે માંકડિંગ આઉટ નહિ ગણાય, પરંતુ ICCએ તેને રનઆઉટ તરીકે માન્ય રાખ્યું છે. ICCના ચીફ એક્ઝિક્યુટીવ કમિટીએ મંગળવારે નિયમોમાં બદલાવે મંજૂરી આપી દીધી છે. ICCએ બોલ ચમકાવવા માટે લાગુ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહિ, બેટરનો ટાઈમ પિરિયડ પણ ઓછો કરી દીધો છે. ચીફ એક્ઝિક્યુટીવ કમિટીએ સૌરવ ગાંગુલીની આગેવાનીમાં બનેલી કમિટીના આ પ્રસ્તાવોને મંજૂરી આપી દીધી છે. ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ બદલાયેલા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે. એટલે કે 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં યોજાનારા T20 વર્લ્ડ કપ આ બદલાયેલા નિયમોની હેઠળ રમાશે.

બટલરને માંકડિંગ કરીને ચર્ચામાં આવ્યો હતો.

T20 વર્લ્ડ કપ પહેલા નવો લૂક

કોહલીએ હેર કટ કરાવ્યા; સેલિબ્રિટી હેર આર્ટિસ્ટે ફોટો પોસ્ટ કર્યા, ઓસ્ટ્રેલિયા સામે નવા અંદાજમાં જોવા મળશે

લોક પત્રિકા | મોહાલી

વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે નવા અંદાજમાં જોવા મળશે. પછી તે વાત બેટિંગની હોય કે નવા લૂકની. કોહલી એશિયા કપ દરમિયાન પોતાના ફોર્મમાં વાપસી કરી ચૂક્યો છે. હવે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને નવો લૂક પણ અપનાવ્યો છે. ત્રણ મેચની T20 સિરીઝ પહેલાં વિરાટ કોહલીએ સ્ટાઈલિશ હેર કટ કરાવ્યા છે. સેલિબ્રિટી હેર આર્ટિસ્ટ રાશિદ સલમાનીએ શનિવારે કોહલીનો ફોટો પોસ્ટ કરી લખ્યું - 'ન્યૂ લૂક ફોર કિંગ કોહલી'. તમને જણાવી દઈએ કે કોહલી તેના સ્ટાઈલિશ હેર કટને લઈ કેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે. મોહાલીમાં પ્રથમ મુકાબલો રમશે ટીમ ઈન્ડિયા મંગળવારે મોહાલીમાં પ્રથમ T20 મેચ રમશે. ત્રણ મેચની T20 સિરીઝ પછી ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સાથે પણ T20 સિરીઝ રમશે. આ બંને સિરીઝ વર્લ્ડ કપની દૃષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ છે. ટીમ શનિવારે રાતે મોહાલી પહોંચી છે. વિરાટ પણ ટીમની સાથે પહોંચ્યો છે.



ગૌતમ ગંભીરે કહ્યું: કોહલી અને ધોનીની પૂજા કરવાનું બંધ કરો

પૂર્વ ક્રિકેટર બોલ્ડો-કેન્સ, બ્રોડકાસ્ટર્સ ભારતીય ક્રિકેટની ઈજ્જત કરે, સ્ટાર ના બનાવે

લોક પત્રિકા | નવી દિલ્હી

ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનિંગ પ્લેયર ગૌતમ ગંભીરે ઈન્ડિયન ક્રિકેટરને સ્ટાર બનાવવાના કલ્પર ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે '1983ના વર્લ્ડ કપથી આનું ચાલતું આવે છે. કપિલ દેવે માત્ર વર્લ્ડ કપ નહોતો અપાવ્યો, પરંતુ તેમને સ્ટાર બનાવીને તેમની પૂજા કરવા લાગ્યા હતા. આનું જ ધોની અને કોહલી સાથે પણ થયું છે. માત્ર આ બંનેએ જ ભારતને જીત આપી નથી.' ગૌતમ ગંભીરે કેન્સ અને બ્રોડકાસ્ટર્સ ઉપર પણ ભેદભાવ ઠીક ઠીક કરવાની ઈજ્જત કરવાનું બંધ કરવાની જણાવ્યું હતું કે 'સિંગ રૂમમાં સ્ટાર અથવા હીરો જન્મ લેતા નથી. ભારતીય ક્રિકેટ જ સાચા હીરો છે. આપણે કોઈ એક પ્લેયરને મોટો બનાવવાની જગ્યાએ પૂરી ટીમને

મોટા બનાવવા ઉપર જોર અને ધ્યાન લગાવવું જોઈએ. કેન્સ અને પાસ કરીને મેચના બ્રોડકાસ્ટર્સને આ વાત વિચારવી જોઈએ. તેમણે ભારતીય ક્રિકેટની ઈજ્જત કરવી જોઈએ. કોઈ એક પ્લેયરની નહિ.' ગંભીરે એશિયા કપનું ઉદ્ઘાટન આપતાં કહ્યું હતું કે 'જે દિવસે વિરાટ કોહલીએ 71મી સેન્યુરી ફટકારી હતી, તે જ મેચમાં નાનકડા શહેર મેરઠના પ્લેયર ભુવનેશ્વર કુમારે પણ 5 વિકેટ ઝડપી હતી. કોઈએ તે વાતને ધ્યાને પણ લીધી નહોતી. આ સાથે જુદાં જુદાં પૂર્ણ વાત કહેવાય. હું એકલો વ્યક્તિ હતો કે જે કોમેન્ટીમાં ભુવનેશ્વરને લઈને સતત ચર્ચા કરતો હતો. ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં માત્ર 4 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. પરંતુ મને નથી લાગતું કે આ વિશે કોઈને યાદ હશે.' ગૌતમ ગંભીરે આટલેથી રોકાવો નહોતો અને વિરાટ કોહલીની સેન્યુરી પછી દેશમાં જન્મ મનાવવા ઉપર પણ ગુસ્સો કર્યો હતો. તેણે કહ્યું હતું કે 'વિરાટની આ ઈનિંગમાં ખૂબ ગુણગાન ગવાયાં છે. પૂરા દેશમાં જન્મનો માહોલ હતો.'

મંદીના ભણકારા તથા દરમાં વધારાની ચિંતા પાછળ રોકાણકારો ક્રિપ્ટોથી દૂર

લોક પત્રિકા | નવી દિલ્હી

નિયમનકારી ચિંતાઓ તથા વિશ્વભરની કેન્દ્રીય બેન્કો દ્વારા વ્યાજ દરમાં આક્રમક વધારાની દહેશતે ક્રિપ્ટોકરન્સીના ભાવમાં સોમવારે નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો. મુખ્ય ક્રિપ્ટો બિટકોઈનનો ભાવ રૂપિયા ૧૮૦૦૦ ડોલરની અંદર સરકી ગયો હતો. વૈશ્વિક મંદીના ભણકારા તથા વ્યાજ દરમાં વધારાની ચિંતા વચ્ચે રોકાણકારો જોખમી એસેટ્સથી હાલમાં દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. બજાર મૂલ્યની દ્રષ્ટિએ સૌથી મોટી ક્રિપ્ટો બિટકોઈન સોમવારે આઠ ટકાથી વધુ તૂટી મોડી સાંજે ૧૮૩૮૦ ડોલર બેઠો હતો. બિટકોઈનનો ભાવ ત્રણ મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. એથરનો ભાવ ૧૨૮૫ ડોલર સાથે બે મહિનાની નીચી સપાટીએ ક્યોટ કરાતો હતો. મુખ્ય ક્રિપ્ટોકરન્સીઓની પાછળ અન્યના ભાવ પણ ઘટાડા તરફ રહ્યા હતા. બજારને તેજીનું કારણ મળતું નહીં હોવાનું પ્લેયરોએ માની રહ્યા છે. દરેક ક્રિપ્ટોકરન્સીઓની મૂલ્યને માર્કેટ કેપ ૮૫૮ અબજ ડોલર જોવા મળી હતી જે જુલાઈના મધ્ય બાદ સૌથી નીચી છે. જોખમી એસેટ્સ માટેનું માનસ હાલમાં સાનુકૂળ જણાતું નથી એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું. અમેરિકામાં ફુગાવો ફરી ઊંચો આવ્યા બાદ ફેડરલ રિઝર્વ



મંદીના અંધાણ: નોકરિયાત વર્ગ માટે વર્લ્ડ બેન્કનો આ રિપોર્ટ મહત્વનો

લોક પત્રિકા | નવી દિલ્હી

શુ મંદીના ભણકારા ઝડપથી વાગી રહ્યા છે? છેલ્લા અમુક સમયથી મંદીને લઈને આશંકાઓ વર્તાવાઈ રહી હતી તે હવે નક્કર સ્વરૂપ લેતી જોવા મળી રહી છે. વર્લ્ડ ઈકોનોમીના મંદીથી ઘેરાવાની ભવિષ્યવાણી કરનારા દિગ્ગજ અર્થશાસ્ત્રીઓની વિસ્તૃત ટીકાઓ આ મળી રહી છે અને હવે વર્લ્ડ બેન્કની એક રિપોર્ટ ચિંતા ઊભી કરી રહી છે. રિપોર્ટ અનુસાર સમગ્ર દુનિયાના કેન્દ્રીય બેન્ક જે રીતે વ્યાજદર વધી રહી છે તેનાથી 2023માં ગ્લોબલ અર્થવ્યવસ્થા મંદીનો શિકાર થઈ શકે છે. મંદીના ડરને નોકરિયાત લોકોમાં વધુ ડર ઊભો કર્યો છે કેમ કે તેમના મગજ પરથી અત્યાર સુધી કોવિડના સમયની છંછેરીની યાદો ભૂંસાઈ નથી. આર્થિક પેકેજના નામે અર્થ, ચીનમાં ક્રોવિડ પ્રતિબંધોથી સપ્લાય



ચેનને પહોંચેલા નુકસાન અને યુકેન પર રેશિયાના હુમલાઓએ પેટ્રોલ-ડીઝલ અને બાધાનની મોટી કિંમતોને દાયકાઓની વિચારણા સુધી પહોંચાડી દીધી છે. અમેરિકા કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વથી લઈને, બેન્ક ઈંગ્લેન્ડ, જાપાની કેન્દ્રીય બેન્ક અને મોંઘવારીને કાબૂ કરવા માટે વ્યાજદરને વધારવાની તૈયારી કરી

લીધી છે. ચીનના કેન્દ્રીય બેન્કને વ્યાજ દર વધારવાની તૈયારી તો કરી નથી પરંતુ તેણે વ્યાજદરોમાં ઘટાડો રોકી દીધો છે. વ્યાજદરને વધારવાથી કંપનીઓ અને સામાન્ય ગ્રાહકો બંને માટે લોન મોંઘી થઈ જાય છે. કંપનીઓ પોતાના વિસ્તરણને રોકી દે છે અને સામાન્ય ગ્રાહક ખર્ચ ઓછા કરવા લાગે છે. આનાથી ડિમાન્ડ

ઠીક થઈ જાય છે. આનાથી અર્થવ્યવસ્થાનું મંદીમાં ફસાવાનું જોખમ વધી જાય છે. આર્થિક ગતિવિધિઓમાં મંદીની સૌથી મોટી અને ઊંડી અસર નોકરીઓ પર પડે છે. નોકરી કરતા લોકોને શું કરે? ગ્લોબલ અર્થવ્યવસ્થા વર્તમાન સ્થિતિમાં આ જ તરફ વધી રહી છે. મંદીના મુરોબી નોકરીઓ જવાની આશંકાઓએ નોકરિયાત લોકોને ડરાવી દીધા છે. ગયા અઠવાડિયા વર્લ્ડ બેન્કને એક રિપોર્ટ જારી કર્યો છે તે અનુસાર ગ્લોબલ ઈકોનોમીમાં રિકવરી બાદની સૌથી મોટી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ 1970 બાદ આ પ્રકારનો સૌથી મોટો ઘટાડો છે. દુનિયાની ત્રણ મોટી અર્થવ્યવસ્થા અમેરિકા, ચીન અને યુરોપીય અર્થવ્યવસ્થાઓમાં ઝડપથી ઘટાડો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિમાં ગ્લોબલ ઈકોનોમી પર પડેલી સામાન્ય ઈજા આને મંદીમાં પહોંચી શકે છે. દુનિયાની દિગ્ગજ ડિવેલપીંગ કંપની ફેડરેશનને રોકાણકારોને કહ્યું છે કે તેમની પેકેજ ડિવેલપીંગમાં ભારે ઘટાડો આવી શકે છે. એશિયા અને યુરોપમાં પરિસ્થિતિ વધારે ખરાબ હોવાની આશંકા છે. આનાથી તેમના બિઝનેસ ઓપરેશન પર ખૂબ અસર પડશે. કંપનીને કરોડો ડોલરના નુકસાનની આશંકાએ ગુરૂવારે આના શેરને 20 ટકા સુધી ઘટાડી દીધા. માત્ર ફેડરેશન જ નહીં પરંતુ અમેરિકા, ડોમેસ્ટ પોસ્ટ અને રોયલ મેલ જેવી ડિવેલપીંગ કંપનીઓના શેર પણ પડી ગયા. ફેડરેશનને કહ્યું છે કે ડિમાન્ડમાં ઘટાડાને કારણે કંપની પોતાની સર્વિસમાં ઘટાડો કરી શકે છે. તેઓ પોતાની ઝડનો ઓફિસ બંધ કરવાનું આયોજન કરી રહ્યા છે. આનાથી આના સેક્ટોર કમ્પ્યુટરની નોકરીઓ પર તલવાર લટકી ગઈ છે.

આગામી માસથી નવી મોસમમાં રૂનું ઉત્પાદન 15% ઊંચું રહેશે

લોક પત્રિકા | મુંબઈ

આગામી મહિનાથી શરૂ થનારી ૨૦૨૨-૨૩ની નવી રૂ મોસમમાં દેશમાં રૂનું ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૬ ટકા વધુ રહેવાની પારખા મૂકવામાં આવી રહી છે. જો કે હવામાનીની સ્થિતિ કેટલી સાનુકૂળ રહેશે તેના પર પણ ઉત્પાદનનો આધાર રહેલો છે, એમ સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ)ના સુત્રોએ જણાવ્યું હતું. રૂના ઊંચા ભાવ તથા અછલતને કારણે દેશની પચાસ ટકા સ્પિનિંગ મિલ્સ બંધ પડી જવાની કેન્દ્ર સરકારને ચિંતા સલાતી રહી છે. રૂના ભાવ જ્યારે ટેકાના ભાવથી નીચે ચાલી જાય છે ત્યારે સીસીઆઈ રૂની ખરીદી કરી ખેડૂતોને ટેકો પૂરો પાડે છે. ઓક્ટોબરથી શરૂ થનારી નવી રૂ મોસમમાં દેશનું રૂ ઉત્પાદન ૧૦૦ કિલોની એક એવી ૩૫૦ લાખ ગાંસડી રહેવાનો સીસીઆઈએ



અંદાજ મુક્યો છે. વર્તમાન મોસમમાં રૂના ભાવ પ્રતિ પાંડી જે જાન્યુઆરીમાં રૂપિયા ૬૦,૦૦૦ હતા તે વધી રૂપિયા ૧.૧૦ લાખ પહોંચી ગયા હતા. નવી મોસમમાં પણ સારા ભાવ મળી રહેવાની અપેક્ષાએ ખેડૂતોએ વર્તમાન ખરીદી મોસમમાં ક્યાસનું વધુ વાવેતર કર્યું છે. પ્રાપ્ત ઓંકડા પ્રમાણે રૂનું વાવેતર

તીવ્ર વધઘટને કારણે રૂ. 24,000 કરોડના IPOનું ભવિષ્ય અદ્ધરતાલ

લોક પત્રિકા | નવી દિલ્હી

ભારતીય શેરબજારમાં છેલ્લા છ-આઠ મહિનાથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સેકન્ડરી માર્કેટની આ અણપારી ચાલની અસર પ્રાઈમરી માર્કેટ પર જોવા મળી શકે છે. ૧૯ કંપનીઓની IPO બહાર પાડવા માટે એક વર્ષની સેબી દ્વારા આપવામાં આવતી નિયમનકારી મંજૂરી આગામી બે મહિનામાં સમાપ્ત થવા જઈ રહી છે. બજાર અહેવાલ અનુસાર આમાંથી મોટા ભાગના આઈપીઓ નિર્ધારિત સમયમર્યાદામાં બજારમાં આવી શકે તેમ નથી. બેંકર્સ પાનગી ધોરણે આપેલા આ માહિતી સાથે જણાવ્યું છે આ પ્રકારના આઈપીઓનું કદ રૂ. ૨૨,૦૦૦-૨૪,૦૦૦ કરોડની આસપાસ છે. કંપનીઓ પાસે રેગ્યુલેટરી મંજૂરીઓ જવા દેવા અથવા તેમનો આઈપીઓ પરત ખેંચીને ફરી ફાઈલ કરવાનો વિકલ્પ છે. તાજેતરમાં જ જેમિની ઓર્ગેનિકલ એન્ડ ફેડરલ ઈન્ડિયાએ રૂ. ૨૫૦૦ કરોડનો આઈપીઓ પરત ખેંચી લીધો હતો. આ સિવાય સ્ટીયર ટેકસટાઈલ્સ અને એસએસબીએ ઈનોવેશન્સે ઓગસ્ટમાં તેમના ઓફર ડોક્યુમેન્ટ્સ પરત ખેંચ્યા હતા. આ સિવાય ભારતની સૌથી મોટી ઓનલાઈન ફાર્મસી, ફાર્મટોનીના માલિક એપીઆઈ હોલિંગ્સે ગયા મહિને બજારની સ્થિતિ અને વ્યૂહાત્મક બાબતોને ટાંકીને ભરણું પરત ખેંચ્યું હતું. હવે તેઓ રાઈટ્સ ઈશ્યુ દ્વારા ભંડોળ એકત્ર કરવાની યોજના



ધરાવે છે. ઘણી મોટી કંપનીઓએ મે અને જુલાઈ વચ્ચે રોડ-શો કર્યા હતા અને રોકાણકારો તરફથી નબળો પ્રતિસાદ મળ્યો હતો કારણ કે બજારમાં ભારે ઉથલપાથલ હતી. બેંકર્સના જણાવ્યા અનુસાર બજારને ડબ્બુ પણ અસ્થિર છે. અમુક મજબૂત કંપનીઓ આગળ વધશે પરંતુ આઈપીઓને યોગ્ય પ્રતિસાદની આશા તેમને પણ નથી. આ સિવાય કંપનીઓ હવે ભંડોળની તાત્કાલિક જરૂર હોય તો અન્ય વિકલ્પો તરફ પણ વિચારી રહી છે. ગયા અઠવાડિયા ઉજિવન સ્મોલ ફાઈનાન્સ બેંકે ક્વોલિફાઈડ ઈન્ટરન્યુશનલ પ્લેસમેન્ટ દ્વારા રૂ. ૪૭૫ કરોડ ઊભા કર્યા હતા. ઓગસ્ટમાં એચુ સ્મોલ ફાઈનાન્સ બેંકે સંસ્થાકીય રોકાણકારો પાસેથી આશરે રૂ. ૨૦૦૦ કરોડ એકત્ર કર્યા હતા. સેબી તરફથી લગભગ રૂ. ૧ લાખ કરોડના ઈશ્યુ સાથે ૬૦ કંપનીઓને નિયમનકારી મંજૂરી મળી ચૂકી છે. આ સિવાય અન્ય ૪૬ કંપનીઓ નિયમનકારી મંજૂરીની રાહ જોઈ રહી છે જે અંદાજે ૬૦,૦૦૦ કરોડ એકત્ર કરી શકે છે.

વૈશ્વિક ડોલર ઉછળીને 20 વર્ષની ટોચે : ચીનની કરન્સી તૂટી 26 મહિનાના તળિયે

યુએસ ઉપરાંત જાપાન તથા બ્રિટનમાં પણ વ્યાજ વૃદ્ધિના વાગતા ભણકારા અમેરિકામાં આ સપ્તાહે થનારી વધુ વ્યાજ વૃદ્ધિ પર નજર

લોક પત્રિકા | નવી દિલ્હી

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ બેતરફી વધઘટ પછી ધીમા સુધારા સાથે પ્લસમાં બંધ રહ્યા હતા. શેરબજાર ઘટયા પછી ફરી ઉચ્ચતામાં કરન્સી બજાર પર તેની અસર જોવા મળી હતી. આ સપ્તાહમાં મળનારી અમેરિકન ફેડરલ રિઝર્વની મિટિંગ ઉપરાંત બેન્ક ઓફ ઈંગ્લેન્ડ તથા બેન્ક ઓફ જાપાનની મિટિંગ પર બજારના પ્લેયરોની નજર રહી હતી. દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ. ૭૮.૭૫ વાળા સવાર રૂ. ૭૮.૬૮ પુલે નીચામાં ભાવ રૂ. ૭૮.૫૮ થયા પછી ભાવ ફરી ઉચ્ચાઈવે ઉંચામાં રૂ. ૭૮.૭૮ થઈ રૂ. ૭૮.૭૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ફરી વધી ૧૧૦ પાર કરી ઉંચામાં ૧૧૦.૧૨ થઈ ૧૧૦.૦૭ રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ડોલર ૨૦ વર્ષની ટોચ નહક પહોંચ્યો છે. વિશ્વ બજારમાં કૂડતેલ ઉંચેલી ઘટાટો કરન્સી બજારમાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.



વિશ્વ બજારમાં ડોલરની મજબૂતાઈ વચ્ચે ડોલર સામે ચીનની કરન્સી યુઆનના ભાવ ઘટી ૨૬ મહિનાના તળિયે ઉતરી ગયાના નિર્દેશો હતા. દરમિયાન, ભારતની એક બેન્ક સાથે રેશિયાની એક બેન્કે કરાર કર્યો છે તથા આના પગલે રૂપિા-બેન્કનો ઉભયપક્ષી વેપાર (ટ્રેડ) શરૂ થવાની શક્યતા બજારના જણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, મુંબઈ બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૨ પૈસા ઘટયા હતા. પાઉન્ડના ભાવ રૂ. ૮૦.૬૩ રહ્યા હતા. યુરોપીયન કરન્સી યુરોના ભાવ ઉંચામાં રૂ. ૭૮.૭૧ થઈ રૂ. ૭૮.૫૧ રહેતા નજીવા પ્લસમાં બંધ રહ્યા હતા. જો કે જાપાનની કરન્સી આજે રૂપિયા સામે ૦.૨૫ ટકા તૂટી હતી સામે ચીનની કરન્સી ૦.૨૫ ટકા માર્જિનમાં રહ્યાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. ભારતમાં ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યાના નિર્દેશોની મુંબઈ કરન્સી બજારમાં પાસ્ટી ચર્ચા સંભળાઈ રહી હતી.

વજન ઘટાડવા આ આયુર્વેદિક ચૂર્ણ, થોડો સમયમાં જ મળશે રિઝલ્ટ

આ આયુર્વેદિક ચૂર્ણ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પાઉચરથી તમે વજન ઘટાડવાની સાથે પાચનમાં પણ સુધારો કરી શકો છો. આવો જાણીએ આ વિશે

સ્થૂળતા આજકાલ લોકો માટે મોટી સમસ્યા બની ગઈ છે. જો તમે વધતી સ્થૂળતાથી પરેશાન છો, તો આ આયુર્વેદિક ચૂર્ણ આપના માટે રામબાણ સાબિત થઈ શકે છે. આયુર્વેદમાં છુપાયેલ પાવડર પેટની ચરબી ઘટાડવાની સાથે વધારાની ચરબી પણ ઘટાડે છે. તે મેટાબોલિઝમને પણ વેગ આપી શકે છે. આવો જાણીએ વજન ઘટાડવા માટે કયા પાવડરનું સેવન કરવું જોઈએ.

વજન ઘટાડવા માટેના ચૂર્ણ

ત્રિફળ પાવડરથી વજન ઘટાડવા માટે ત્રિફળ ચૂર્ણ સ્વાસ્થ્યપ્રદ સાબિત થઈ શકે છે. આ પાવડર ત્રણ ફળોનું મિશ્રણ છે, જે સ્થૂળતા ઘટાડે છે. આ પાવડરનું સેવન કરવા માટે, 1 ચમચી ત્રિફળ પાવડર લો. તેને સવારે ખાલી પેટ ગરમ પાણી સાથે લો. તેનાથી થોડા દિવસોમાં સ્થૂળતા ઓછી થઈ શકે છે. આ સાથે તે અનેક જીવલેણ રોગોને પણ દૂર કરી શકે છે.

ક્લાંજનો પાવડર

ક્લાંજ પાવડર પેટની ચરબી ઘટાડે છે ક્લાંજમાં હાજર પોષક તત્ત્વો વજન ઘટાડી શકે છે. આનાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. આ પાવડરનું સેવન કરવા માટે 100 ગ્રામ ક્લાંજ લો. હવે તેને સારી રીતે શેકીને પીસી લો. ત્યાર બાદ તેને ગરમ પાણી સાથે સેવન કરો. આ તમારા વજનને ખૂબ જ ઝડપથી ઘટાડી શકે છે. આ સાથે નિયમિત કસરત કરો અને યોગ આહારનું પાલન કરો.

અજમાનો પાવડર

અજમાનો પાવડર વજન ઘટાડે છે અજમાનો પાવડર તમને પાચનમાં વિક્ષેપ તેમજ વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તે તમારા પેટને ઠંડુ રાખવામાં અસરકારક છે. તેનું સેવન કરવા માટે અજમાને જરા શેકી લો અને તેનો પાવડર બનાવી લો. ત્યાર બાદ તેને ઠંડા પાણી સાથે ખાઓ. તેનાથી વજનમાં ઘટાડો થઈ શકે છે. આની સાથે પાચનક્રિયામાં થતી ગડબડ પણ દૂર થશે.



નવરાત્રિમાં વાળની રાખો ખાસ સંભાળ, માવજત માટે આજથી જ શરૂ કરી દો આ વસ્તુઓનો ઉપયોગ

જરાતમાં નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સિવાય કુર્મી, રત્ન, રત્ન, રત્ન તહેવારોની શરૂઆત પણ દુર્ગાપૂજા અને નવરાત્રિઓની શરૂઆત રહી છે. ભારતમાં ત હવે 1 રોની ઉજવણી હંમેશા ખાસ હોય છે.

કલર શેમૂ રહેશે બેસ્ટ

જો તમે વાળમાં કલર ટ્રીટમેન્ટ કરાવી લીધી હોય તો આ પ્રકારના વાળની દેખભાળ માટે નેચરલ બેઝ્ડ શેમૂનો ઉપયોગ કરો. જો હેર કલરને વધારે સમય થઈ ગયો હોય તો નેચરલ હિના ક્રિમનો ઉપયોગ કરો, માકેટમાં ઉપલબ્ધ વાળમાં બે કલાક સુધી લગાવીને રાખો. આ પ્રકારની ક્રિમ બેઝ્ડ મહંદી વાળમાં 20 દિવસ સુધી રહેશે અને તમને મળશે સ્મૂથ હેર.

વધારે સ્ટાઈલિસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ

નવરાત્રિમાં આખી રાત સુધી ગરબાનો કાર્યક્રમ ચાલતો હોય છે. ખાસ કરીને વર્કિંગ વિમેન્સને દિવસ દરમિયાન વાળની સંભાળ રાખવાનો સમય રહેતો નથી. તેથી જ વાળને વધારે નુકસાનથી બચાવવા માટે સ્ટાઈલિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ ટાળો. તેના બદલે એવી સ્ટાઈલિસ્ટ હેરસ્ટાઈલ પસંદ કરો જેમાં ઓછા સ્ટાઈલિસ્ટ પ્રોડક્ટ્સનો ઉપયોગ થાય. વાળને વધારે જોરથી ના બાંધો નહીં તો તે તૂટવાનો ભય રહે છે.

તહેવાર દરમિયાન વારંવાર હેરસ્ટાઈલ કે સ્ટાઈલિંગથી થતા નુકસાનથી બચવા માટે ઓર્ગેનિક શેમૂનો ઉપયોગ કરો. આનાથી તમારું સ્કાલ્પ અને વાળ સ્વસ્થ રહેશે ઉપરાંત વાળને પણ પોષણ મળતું રહેશે. આ સિવાય સપ્તાહમાં બે વખત હેર સ્પા પણ કરાવી શકાય છે.



વિશ્વમાં 1 અબજ લોકો ગંભીર સ્લીપ એપનિયાથી પીડિત, ઉંઘમાં યાચ છે બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ; જાણો ઘલાજ



આ રામની ઉંઘ કિસ્મતથી મળે છે - આ લાઈન તમે કોઈ મૂવી કે સીરિયલમાં અલગ છે. વિશ્વમાં ઘણાં એવા લોકો છે જેઓને પથારીમાં પડતાની સાથે જ ઉંઘ આવી જાય છે. જ્યારે કેટલાંક લોકોને ઉંઘમાં બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ એક પ્રકારે મેડિકલ કન્ડિશન છે જેને ડોક્ટર્સ સ્લીપ એપનિયા કહે છે.

અનુસાર, સ્લીપ એપનિયા કે ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા એવી બીમારી છે જેમાં ઉંઘતી વખતે શ્વાસ વારંવાર અટકીને ચાલે છે, ઘણીવાર શ્વાસ ઉંઘમાં જ રોકાઈ જાય છે. આ સમસ્યા 1 સેકન્ડથી લઈને 1 મિનિટ સુધીના અંતરાલમાં પણ થઈ શકે છે. ResMedમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, વિશ્વમાં અંદાજિત 936 મિલિયન લોકો આ બીમારીથી પીડિત છે, આ આંકડો અગાઉના રિસર્ચ કરતાં 10 ગણો વધારે છે. આ બીમારીની ગંભીરતાનો અંદાજ એ બાબતથી લગાવી શકાય છે કે, ઉંઘમાં વ્યક્તિના શ્વાસોચ્ચાસની પ્રક્રિયા સંદર્ભે બંધ થઈ જાય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિને હૃદયરોગ ઉપરાંત શ્વાસ લેવાની તકલીફ સહિત અન્ય બીમારીઓ અને ટાઈપ-2 ડાયાબિટીસ (Type-2 Diabetes) પણ થઈ શકે છે. ઉપસલા યુનિવર્સિટી, સ્વિડન (Uppsala University, Sweden)ની રિસર્ચ ટીમ દ્વારા હાથ ધરાયેલા એક સંશોધન અનુસાર, જે લોકોને સ્લીપ એપનિયાની બીમારી હોય તેઓને બ્લડ સ્ક્રીનિંગની ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે, ઉપરાંત લાંબા ગાળે વ્યક્તિને ફેફસાંનું કેન્સર અને શ્વાસનને લગતી તકલીફ પણ થઈ શકે છે.

શું છે સ્લીપ એપનિયા ?

માયો ક્લિનિક અનુસાર, સ્લીપ એપનિયા એક ગંભીર સ્લીપ ડિસઓર્ડર છે જેમાં વારંવાર શ્વાસોચ્ચાસની પ્રક્રિયા બંધ થઈ જાય છે અને ફરીથી શરૂ થઈ જાય છે. જો તમે જોરજોરથી નસકોરાં બોલાવો છો અને આખી રાત ઉંઘ બાદ પણ યાચનો અનુભવ કરો છો તો તમને સ્લીપ એપનિયા હોઈ શકે છે. આ ત્રણ પ્રકારના હોય છે - સેન્ટ્રલ, ઓબ્સ્ટ્રક્ટિવ અને ક્રોમ્યલેક્સ સ્લીપ. જેમાં સૌથી સામાન્ય ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા છે.

બખી લહેરીએ ગુમાવ્યો હતો જીવ

બોલિવૂડના પ્રખ્યાત સિંગર બખી લહેરીનું 69 વર્ષની ઉંમરે ફેફસાંથી 2022માં નિધન થયું હતું, જેનું મુખ્ય કારણ ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા હતું. સૂતી વખતે આપણી ઉંઘ ચાર ચરણમાંથી પસાર થાય છે, જેમાં બ્લડપ્રેશર અને શ્વાસોચ્ચાસમાં ઉતાર-ચઢાવ પણ સામેલ છે. સામાન્ય રીતે સૂતી વખતે આપણી માસપેશીઓ આરામની મુદ્રામાં હોય છે, પરંતુ જો ગળાની પેશીઓ વધારે તણાવમુકત થઈ જાય તો અંદર હવા જતો રસ્તો બંધ થઈ જાય છે અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે.

કેવા લોકોને છે આ બીમારીનું જોખમ ?

અમેરિકાના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાન અનુસાર, કેટલાંક લોકોમાં ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા વિકસિત થવાની સંભાવના વધારે હોય છે. જે તેઓ મેદસ્વિતા, યુગ્મપાન અને આલ્કોહોલનું સેવન કરતાં હોય ઉપરાંત આ સમસ્યા વારસાગત પણ હોઈ શકે છે. આ સમસ્યા પુરુષો અને વૃદ્ધોમાં સૌથી વધારે જોવા મળે છે.

બોલીવુડ

'બિગ બોસ' ફેમ નિક્કી તંબોલીનો કાતિલ અંદાજ



મુંબઈ // ટેલિવિઝનની સ્ટાર એક્ટ્રેસ અને દક્ષિણ ભારતીય ફિલ્મોમાં પોપ્યુલર થઈ ચૂકેલી હીરોઈને નિક્કી તંબોલી આજકાલ ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં જ નિક્કી તંબોલીનું નામ ઈડી તપાસમાં પણ ઉછળ્યું છે. પરંતુ આ બધાની વચ્ચે તે સોરયલ મીડિયા પર પણ એક્ટિવ થઈ ચૂકી છે. તેને તાજેતરમાં જ ફરી એકવાર પોતાનો બોલ્ડ અને સેક્સી અંદાજ ફેન્સ સામે શેર કર્યો છે. નિક્કી તંબોલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસ્વીરો શેર કરી છે, જેમાં તેનો અંદાજ ખુબ જ સેક્સી છે, આમાં તે પોતાની સેક્સી બોડી અને લેગ્સને ફ્લોન્ટ કરી રહી છે. નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી. નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે. 'બિગ બોસ' સિવાય નિક્કી તંબોલી 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે. ટૂંક સમયમાં તે 'ઝલક દિખલા જા'માં પણ સ્પર્ધક તરીકે જોવા મળશે.



માલદીવમાં દરિયા કિનારે રેતીમાં આળોટી સની લિયોની

મુંબઈ // તેલુગુ ફિલ્મ 'જિન્ના'માં જોવા મળેલી અભિનેત્રી સની લિયોની તેના માલદીવ વેકેશનની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આમાં તે પિંક ફ્લોરલ બિકીનીમાં જોવા મળી છે. તસવીરોમાં તે દરિયા કિનારે રેતીમાં સુનેલી જોવા મળે છે. સિનેમા જગતમાં એક અલગ જ ઓળખ બનાવનાર અભિનેત્રી સની લિયોનીએ આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. આવી સ્થિતિમાં તે આ દિવસોમાં ફિલ્મોથી દૂર પરિવાર સાથે રજાઓ ગાળવા માલદીવ ગઈ છે. જ્યાંથી એક્ટ્રેસે સિઝલિંગ પોઝ આપ્યા છે. સની લિયોની માલદીવમાં છે અને પતિ રેનિયલ સાથે તેના જીવનની સુંદર ક્ષણો વિતાવી રહી છે.

સનીએ હાલમાં જ તેને તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યાં છે. તેના આ ફોટો વાઈરલ થઈ રહ્યા છે. સની લિયોનીની આ લેટેસ્ટ તસવીરોમાં તેમને જોઈ શકો છો કે અભિનેત્રી પિંક કલરની બિકીનીમાં પોતાની હોટનેસ ફેલાવી રહી છે ફોટોમાં સની લિયોની પછી એક કિલરને પોઝ આપતી પણ આ ફોટો પસંદ આવી રહ્યા માલદીવ ટૂરની તસવીરોને મીડિયામાં લાખોમાં વાઈરલ થઈ હતી.



ધ કપિલ શર્મા શો: કૃષ્ણા અભિષેક બાદ હવે શોમાં 'ચંદુ ચાવાળાએ' શો છોડ્યો

મુંબઈ // પોપ્યુલર કોમેડી શો ધ કપિલ શર્મા શોમાંથી વધુ એક વિકેટ પડી હોવાના અહેવાલ આવી રહ્યા છે. કૃષ્ણા અભિષેક બાદ હવે ચંદન પ્રભાકર પણ શોમાં નહીં જાવા મળે. ચંદુ ચાવાળાના રોલમાં જોવા મળતા ચંદન પ્રભાકરે હાલ તો શો છોડ્યો છે અને આમ કરવા પાછળનું કારણ પણ તેણે પોતે જ જણાવી દીધું છે. એક ઈન્ટરવ્યુમાં ચંદન પ્રભાકરે કહ્યું હતું કે તે હવે શોના આગામી એપિસોડમાં જોવા મળશે નથી. તે ફર્સ્ટ એપિસોડમાં જોવા મળ્યો હતો, પરંતુ હવે તે જોવા મળશે નહીં. ઉલ્લેખનીય છે કે ચંદન તથા કપિલ સ્કૂલ ટાઈમના મિત્રો છે. બંને કરિયરની શરૂઆતથી સાથે કામ કરી રહ્યા છે. વધુમાં ચંદને કહ્યું હતું કે તે છેલ્લાં પાંચ વર્ષથી આ શો સાથે જોડાયેલો છે. તે હવે થોડો ટાઈમ બ્રેક લેવા માગતો હતો. તેને લાગ્યું કે જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ સાથે લાંબા સમયથી જોડાયેલા હો તો તમારે બ્રેક લેવો જરૂરી બની જાય છે અને અન્ય બાબતો પર કોક્સ કરવી જોઈએ. તે હવે શોમાં કામ કરવા માગે છે અને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરશે.

રાણવીરનો દાવો, ઈન્ટરનેટ પર વાયરલ ન્યૂડ ફોટો મોર્ફ કરાયેલો છે



મુંબઈ // બોલીવુડ અભિનેતા રણવીર સિંહે ઈન્ટરનેટ પર વાયરલ થયેલો પોતાનો ન્યૂડ ફોટો કોઈએ મોર્ફ કરીને મુક્યો હોવાનું મુંબઈ પોલીસને જણાવ્યું છે. રણવીરે મુંબઈની ચેમ્બુર પોલીસને જણાવ્યું છે કે પોતે કુલ સાત ફોટા અપલોડ કર્યાં હતાં. તેમાં ઈન્ટરનેટ પર વાયરલ થયેલા એ ન્યૂડ ફોટાનો સમાવેશ થતો નથી જેમાં તેના પ્રાઈવેટ પાર્ટ્સ દેખાડવામાં આવ્યા છે. આ ફોટા સાથે કોઈએ ચેડાં કરેલાં છે એમ અભિનેતાએ પોલીસને જણાવ્યું છે. રણવીરે પોતે અમેરિકી મેગેઝિન માટે શૂટ કરાવેલા અને સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા ઓરિજિનલ ફોટા પણ પોલીસને સોંપ્યા છે. રણવીરે અમેરિકી મેગેઝિન માટે ન્યૂડ ફોટો શૂટ કરાવ્યું હતું. તેના ફોટા ઈન્ટરનેટ પર વાયરલ થયા હતા. આ સંદર્ભમાં મુંબઈના ચેમ્બુર પોલીસ મથકે રણવીર સામે અશ્લીલ સામગ્રીના પ્રસારણ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ એફઆઈઆરના સંદર્ભમાં રણવીરે ચેમ્બુર પોલીસ મથકે હાજર થઈ બે કલાક સુધી પોતાનું નિવેદન પણ લખાવ્યું હતું. તેમાં તેણે અમેરિકી મેગેઝિન સાથેના ફોટાશૂટ, આ ફોટો માટેનું શૂટિંગ વગેરે વિગતો આપી હતી.



જયપુરની સિવિલ લાઈન્સ ખાતે રાજ્યમાં ઢોરની ચામડીના રોગથી થતા મૃત્યુ થવાના કારણે ભાજપના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિરોધ પ્રદર્શન રોકવા માટે પોલીસ કર્મી અને ભાજપના કાર્યકરો સંઘ જોવા મળ્યો હતો.

ન્યૂઝ ડિસ્ક



તમિલની અભિનેત્રી પોલિન જેસિકા ઉર્ફે દીપા ચેન્નાઈના ઘરમાં મૃત હાલતમાં મળી

1 નવી મુંબઈ, તા.૨૦ | તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે તમિલની પ્રખ્યાત અભિનેત્રી પોલિન જેસિકા ઉર્ફે દીપાનું ૧૮ સપ્ટેમ્બરે ચેન્નાઈમાં પોતાના ઘરે મૃત હાલતમાં મળી આવી હોવાના અહેવાલ છે. સાઉથ ફિલ્મ 'વેધા'ની અભિનેત્રી પોલિનનો મૃતદેહ પોતાના જ એપાર્ટમેન્ટમાં પંખા સાથે લટકતો મળી આવ્યો હતો. એવી આશંકા છે કે, પોલીને તેના અંગત જીવનમાં મુશ્કેલીના કારણે આત્મહત્યા કરી છે. આ ઘટનાને લઈને પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે. કોયમ્બે પોલીસને જેસિકાના પાડોશીઓએ તેના મૃત્યુ અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કિલપોલ સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. જે બાદ અભિનેત્રીના સંબંધીઓને જાણ કરવામાં આવી હતી અને તેના મૃતદેહને આંધ્રપ્રદેશ મોકલવામાં આવ્યો હતો. પોલીસે કહ્યું, અમે લોકપ્રિય અભિનેત્રી પોલિન જેસિકાની કથિત આત્મહત્યાની દરેક ઝેંગલથી તપાસ કરી રહ્યા છીએ અને સીસીટીવી ની મદદ લઈ રહ્યા છીએ. પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે પોલિનના ઘરે કોણ આવ્યું હતું. આત્મહત્યાના દિવસ પહેલા તે ઓટોમાં તેના એપાર્ટમેન્ટમાં પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે એ પણ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે, આ આત્મહત્યાનો મામલો છે કે પછી કોઈએ તેને આત્મહત્યા કરવા માટે પ્રેરિત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, એક સુસાઈડ નોટ મળી છે જેમાં તેણે ઉલ્લેખ કર્યો છે કે તેના મૃત્યુ પાછળ એક નિષ્ફળ સંબંધ હતો.

એમએમએસ કાંડમાં આરોપી છાત્રાનાં મોબાઈલમાંથી ૧૨ વીડિયો રિકવર થયા

1 ચંદીગઢ, તા.૨૦ | પંજાબના મોહાલી ખાતે આવેલી ચંદીગઢ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેતી ૬૦ જેટલી વિદ્યાર્થીનીઓના કપડાં બદલતા અને સ્નાન કરતા વીડિયો વાયરલ થવાના કાંડ બાદ ભારે હડગમો જોવા મળી રહ્યો છે. શનિવારે સાંજે આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ વિદ્યાર્થીનીઓ આંદોલન પર ઉતરી હતી પરંતુ ડીઆઈજી અને પ્રશાસન દ્વારા નિષ્ફળ તપાસ માટે આશ્વાસન આપવામાં આવ્યું ત્યાર બાદ રવિવારે મોડી રાતે વિદ્યાર્થીનીઓએ પ્રદર્શનોનો અંત આણ્યો હતો. આ મામલે હવે ચોથા આરોપીની એન્ટ્રી થઈ ગઈ છે. સાત દિવસ સુધીના પોલીસ રિમાન્ડ પર મોકલાવેલા ૩ આરોપીઓ (વિદ્યાર્થીની, તેનો બોયફ્રેન્ડ સની મહેતા અને તેનો મિત્ર રંજીત વર્મા)ની પ્રાથમિક પૂછપરછમાં અનેક તથ્યો હાથ આવી છે. વિદ્યાર્થીનીના મોબાઈલમાંથી ૧૨થી વધુ વીડિયો રિકવર કરી લેવામાં આવ્યા છે.

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાયા



1 પંજાબ, તા.૨૦ | પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જોડાઈ ગયા છે. તેમને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય કરી દીધું છે. તેમની સાથે જ ઘણા અન્ય નેતા પણ ભાજપનો ભાગ બની ગયા છે. પંજાબમાં તેમની પાર્ટી કંઈ ખાસ પ્રદર્શન કરી શકી નહીં. કેપ્ટને દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર અને કિરેન રિજિજુ, સુનીલ જાહડ અને પંજાબ ચીફ અશ્વની શર્માની હાજરીમાં ભાજપની પ્રાથમિકતા સદસ્યતા ગ્રહણ કરી. તેમને જણાવી દર્શાવે કે વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટને કોંગ્રેસે નજરઅંદાજ કરી પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી. ચૂંટણી દરમિયાન તેમની પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. તે સમયે તેમના પુત્ર રણદિપ સિંહે જ ભાજપ સાથે તલામેલ ભરી ટિકિટોની વહેંચણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે નામાંકન શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી શશી થરૂર-અશોક ગહેલાત કોંગ્રેસ પ્રમુખની રેસમાં, રાહુલ ગાંધીના નામને લઈને અવટવ

પાર્ટીમાં ચૂંટણી માટે નામાંકનની પ્રક્રિયા ૨૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે જે ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે

1 નવી દિલ્હી, તા.૨૦ | કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી માટે નામાંકન શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં ઉમેદવારોને લઈને સ્થિતિ કંઈક અંશે સ્પષ્ટ થઈ રહી છે. જોકે, વાયનાડના સાંસદ રાહુલ ગાંધી મેદાનમાં ઉતરશે કે નહીં? તે હજુ સ્પષ્ટ નથી. બીજા તરફ જી-૨૩ નેતાઓમાં સામેલ રહેલા શશી થરૂર આ પદ ઠરાવે રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગાંધી પરિવારના નજીકના ગણાતા અશોક ગહેલાત પણ રેસમાં આગળ છે. થરૂર ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે. જોકે, તેમણે આ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ નથી કરી. તાજેતરમાં તેઓ વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા પ હોંચ્યા હતા. બેંકક દરમિયાન તેમણે પાર્ટીના પ્રમુખને અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની ઈચ્છા

1 નવી દિલ્હી, તા.૨૦ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના મેયરોની સભાને સંબોધન કર્યું. દરમિયાન પીએમ મોદીએ ભાજપ મેયરો સમક્ષ વિકાસનો પ્લાન મૂક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં આગામી ૨૫ વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સંમેલનની મોટી ભૂમિકા છે. આપણે રાજકારણમાં માત્ર ગાદી પર બેસવા આવી નથી. સત્તામાં બેસવા આવી નથી. સત્તા આપણા માટે માધ્યમ છે. લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા ક્યા પ્રકારે આપણે જનતાની સેવા કરી શકીએ છીએ તે માટે આપણે કામ કરીએ છીએ. ભાજપનું રાષ્ટ્રીય મેયર સંમેલન

મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના મેયરોની સભાને સંબોધન કર્યું રાજકારણમાં માત્ર ગાદી ઉપર બેસવા આવ્યા નથી, લક્ષ્ય સેવા : પીએમ મોદી

આઝાદીના અમૃત કાળમાં આગામી ૨૫ વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સંમેલનની મોટી ભૂમિકા હોવાનું કહ્યું

1 નવી દિલ્હી, તા.૨૦ | વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભાજપના મેયરોની સભાને સંબોધન કર્યું. દરમિયાન પીએમ મોદીએ ભાજપ મેયરો સમક્ષ વિકાસનો પ્લાન મૂક્યો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદીના અમૃતકાળમાં આગામી ૨૫ વર્ષ માટે ભારતના શહેરી વિકાસનો એક રોડ મેપ બનાવવામાં આ સંમેલનની મોટી ભૂમિકા છે. આપણે રાજકારણમાં માત્ર ગાદી પર બેસવા આવી નથી. સત્તામાં બેસવા આવી નથી. સત્તા આપણા માટે માધ્યમ છે. લક્ષ્ય સેવા છે. સુશાસન દ્વારા ક્યા પ્રકારે આપણે જનતાની સેવા કરી શકીએ છીએ તે માટે આપણે કામ કરીએ છીએ. ભાજપનું રાષ્ટ્રીય મેયર સંમેલન



ગાંધીનગરમાં થઈ રહ્યું છે. રાષ્ટ્રીય મેયર સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું કે સરદાર વલ્લભભાઈ પટેલને મેયર તરીકે પોતાની સફર શરૂ કરી. આપણે એક શ્રેષ્ઠ ભારત માટે તેમના બતાવેલા માર્ગ પર ચાલીશું અને આના વિકાસ માટે કામ કરીશું.

જવાબ છે જેથી આગામી પેઢીઓ તમને યાદ કરે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સામાન્ય નાગરિકોનો સંબંધ જો સરકાર નામની કોઈ વ્યવસ્થાથી આવે છે તો પંચાયતથી આવે છે, નગર પંચાયતથી આવે છે, નગરપાલિકાથી આવે છે, મહાનગર પાલિકાથી આવે છે. તેથી આ પ્રકારના વિચાર-વિમર્શન મહત્વ વધી જાય છે. આપણા દેશના નાગરિકોએ ખૂબ લાંબા સમયથી શહેરોના વિકાસ અંગે ભાજપ પર વિશ્વાસ મૂક્યો છે. તેને નિરંતર જાળવી રાખવો, તેને વધારવો આપણા સૌની જવાબદારી છે. જમીની સ્તરથી કામ કરવું તમામ મેયરોની જવાબદારી છે. શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવે અને વિકાસ નક્કી થાય.

સ્ટેટ બેંકે મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર એસએમએસ ચાર્જ હટાવી દીધો

1 નવી દિલ્હી, તા.૨૦ | દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ગ્રાહકોને મોટી રાહત આપવામાં આવી છે. બેંકે મોબાઈલ ફંડ ટ્રાન્સફર પર એસએમએસ ચાર્જ હટાવી દીધો છે. હવે ગ્રાહકોને આ સુવિધા માટે કોઈ ચાર્જ ચુકવવો પડશે નહીં. હવે એસબીઆઈ ગ્રાહકો ટ્રાન્સફર માટે કોઈ પણ ચાર્જ ચુકવવા

વગર યુએસએસડી સેવાનો લાભ મેળવી શકશે. બેંકે કહ્યું કે આનાથી ગ્રાહકોને પડતા વધારાના ભારણ ઘટી જશે અને ફંડ ટ્રાન્સફરની માહિતી મેળવવાની સુવિધા મળશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે તે મોબાઈલ ફંડ ટ્રાન્સફર માટે એસએમએસ ફીસને ખતમ કરી રહ્યા છે. આ નિર્ણય ગ્રાહકોના પક્ષમાં લેવાયો છે, જેથી તેમને

વધારાનો ભાર પડતો હતો તે ખતમ કરાયો છે. એસબીઆઈના ગ્રાહકો મોબાઈલ દ્વારા યુએસએસડી (અનસ્ટ્રક્ચર્ડ સાલીમેન્ટરી સર્વિસ ડેટા) મોબાઈલનો ઉપયોગ કરી બેંક સ્ટેટમેન્ટ, ટ્રાન્સફરની જાણકારી મેળવે છે. જેના માટે એસબીઆઈ ગ્રાહક પોતાના મોબાઈલમાં *99# નંબર ટાઈપ કરે છે અને બેંક તેમના ખાતામાં રહેલી રકમ, ફંડ

ટ્રાન્સફરની માહિતી સહિત ઘણી પ્રકારની માહિતી મેસેજ દ્વારા મોકલે છે. બેંક આ મેસેજ મોકલવા માટે ગ્રાહકો પાસે ચાર્જ વસૂલતી હતી. જોકે, તેને હવે એસબીઆઈ દ્વારા ખતમ કરાયો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ કહ્યું કે, *99# ટાઈપ કરીને ગ્રાહક મક્કમાં બેંકિંગ સેવાઓનો લાભ પહેલાની જેમ જ લઈ શકે છે.

પટનાથી યુએસ નાગરિકો સાથે સાયબર હુમલા કરતી ગેંગની તપાસ માટે ઈન્ટરપોલીની મદદ લેવાશે

1 નવી દિલ્હી, તા.૨૦ | પટનામાં બેસીને અમેરિકન નાગરિકો સાથે સાયબર હુમલા કરનારી ગેંગની તપાસમાં બિહાર પોલીસ ઈન્ટરપોલીની મદદ લેશે. એડીજી હેડક્વાર્ટર જેએસ ગંગવારે પટનામાં જણાવ્યું હતું કે દિવા પોલીસ સ્ટેશન સાયબર ક્રીડ સંબંધિત કેસમાં ત્રણ શાતિરોની

ધરપકડ કરી છે. પશ્ચિમ બંગાળમાં રહેતા આ ઠગો દ્વારા લોકોને ફસાવવા માટે રિન્ટ સેન્ટર, સ્કાયપ, ટેક્સ્ટ નાઈ જેવી એપનો ઉપયોગ કરવામાં આવતો હતો. તેમણે કહ્યું કે, ઠગોનો આ મામલો વિદેશ સાથે સંબંધિત છે તેથી તેની તપાસ માટે ઈન્ટરપોલીની મદદ લેવામાં આવશે.

નોઈડાના સેક્ટર ૨૧માં જળવાયુ વિહારની ઘટના આ બાઉન્ડ્રી વોલ ૧૦૦ મીટર લાંબી હતી, કાટમાળ નીચે દટાયેલાઓને બચાવવાની કામગીરી ચલાવત

નોઈડામાં બાઉન્ડ્રી વોલ પડતાં ચાર લોકોનાં ફરૂણ મોત

1 નોઈડા, તા.૨૦ | ગૌતમબુદ્ધનગર જિલ્લાના સેક્ટર ૨૧ સ્થિત પોશ વિસ્તારમાં એક બાઉન્ડ્રી વોલ પડવાથી ૪ લોકોના મોત થઈ ગયા છે જ્યારે અન્ય લોકો કાટમાળમાં દટાયા હોવાની સુચના મળી છે. કાલમાં એનડીઆરએફ અને ૪ જેસીબીની સહાયતાથી રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પોલીસ હાઈકમાન્ડ ઘટના સ્થળ પર પહોંચ્યા છે. નોઈડાના સેક્ટર ૨૧માં જળવાયુ વિહારની આ ઘટના છે. ફાયર બ્રિગેડ વિભાગની ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી છે. પ્રામ માહિતી પ્રમાણે આ બાઉન્ડ્રી વોલ ૧૦૦ મીટર લાંબી હતી. આશંકા છે કે અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. એનડીઆરએફ,

પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉચ્ચ અધિકારીઓની સાથે ડોક્ટરો અને એમ્બ્યુલન્સ પણ સ્થળ પર હાજર છે. મૃત્યુ પામેલા લોકોની ઓળખ પપુ, પુષ્પેન્દ્ર, પરા લાલ અને અમિત તરીકે થઈ છે. તમામ મૃતકો યુપીના બદાઉન જિલ્લાના જણાવવામાં આવી રહ્યા છે. ડીએમ સુડાસ એલવાયએ જણાવ્યું કે ક્લાઈમટ બિહાર એપાર્ટમેન્ટના ગટરના રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે આ બાઉન્ડ્રી વોલ ધરાશયી થઈ ગઈ. અત્યાર સુધીમાં ચાર લોકોને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં બે અને કેલાશ હોસ્પિટલમાં બે મૃત્યુ નોંધાયા છે.

૯ ઘાયલોની સારવાર ચાલી રહી છે

૯ ઘાયલોને યોગ્ય સારવાર કરાવવા માટે પણ મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે. ઘટના પર શોક વ્યક્ત કરતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શોકઅસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. ડીએમ અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવાનો સીએમએ નિર્દેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી મૃતકોના પરિજનોને ૯ લાખ રૂપિયાની રાહત રકમ આપવાનો પણ નિર્દેશ આપ્યો છે. તમામ ઘાયલોને યોગ્ય સારવાર કરાવવા માટે પણ મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો છે.

બચાવ કામગીરી ચાલુ છે ડીએમએ કહ્યું કે આ ઘટના કેમ બની, તેની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે નોઈડા ઓથોરિટી દ્વારા કોન્ક્રીટ પર કામ કરવામાં આવી રહ્યું છે. ગટરની ઘટો હટાવતી વખતે આ અકસ્માત સર્જાયો હતો.

ચૂંટણી ફંન્ડિંગને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા કાળાધનથી મુક્ત કરવાની ક્વાયત

રાજકીય પક્ષોને રોકડ ફંડની મર્યાદા ૨૦ હજારથી ઘટાડીને બે હજાર કરવા ચૂંટણી પંચનો પ્રસ્તાવ

1 નવી દિલ્હી, તા.૨૦ | ચૂંટણી પંચે પ્રસ્તાવ આપ્યો છે કે, રાજકીય પક્ષો માટે એક વખતમાં મળનાર રોકડ ફંન્ડિંગની મર્યાદા ૨૦,૦૦૦ રૂપિયાથી ઘટાડી ૨,૦૦૦ રૂપિયા કરવામાં આવે. તથા કુલ ફંડમાં રોકડની મર્યાદા અધિકતમ ૨૦% અથવા ૨૦,૦૦૦ સુધી મર્યાદિત કરવામાં આવે જેથી ચૂંટણી ફંન્ડિંગને કાળાધનથી મુક્ત કરી શકાય. પ્રામ માહિતી પ્રમાણે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુને પત્ર લખીને લોક પ્રતિનિધિત્વ કાયદામાં કેટલાક સુધારાની ભલામણ કરી છે. તેમણે કહ્યું કે, પંચની ભલામણોનો હેતુ રાજકીય પાર્ટીઓને ફંડ આપવાની પ્રણાલીમાં સુધારો અને પારદર્શિતા લાવવાનો છે. કમિશનર આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે તેણે તાજેતરમાં જ રજિસ્ટર્ડ સિસ્ટમથી એવી ૨૮૪ પાર્ટીઓને હટાવી દીધી છે જેઓ નિયમોનું પાલન નહોતી કરી રહી હતી. આવકવેરા વિભાગે તાજેતરમાં કરચોરીના આરોપસર આવા અનેક રાજકીય એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. સુરોનું કહેવું છે કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ

મર્યાદા ૨૦ હજાર રૂપિયાથી ઘટાડીને ૨ હજાર રૂપિયા કરવાની ભલામણ કરી છે. હાલના નિયમો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ ૨૦,૦૦૦ રૂપિયાથી વધુનું તમામ દાન જાહેર કરવું પડશે. આ અંગેનો અહેવાલ પંચ સમક્ષ રજૂ કરવાનો રહેશે. સુરોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલયની મંજૂરી મળી જાય તો ૨૦૦૦ રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે. સુરોએ જણાવ્યું કે, જો આયોગના આ પ્રસ્તાવને કાયદા મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવે તો ૨૦૦૦ રૂપિયાથી વધુના તમામ દાનની જાણ રાજકીય પક્ષોને કરવી પડશે જેનાથી પારદર્શિતા વધશે. કમિશનર એવી પણ ભલામણ કરી છે કે કોઈપણ રાજકીય પક્ષ દ્વારા મળેલા કુલ દાનના મહત્તમ ૨૦% અથવા ૨૦ કરોડ રૂપિયા રોકડ હોવી જોઈએ. ચૂંટણી પંચે એવું પણ ઈચ્છે છે કે, ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ ચૂંટણી માટે એક લગભગ બેંક ખાતું મોલાવવા એકમોના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. સુરોનું કહેવું છે કે, ચૂંટણી પંચે રાજકીય પક્ષોને એક વખતના રોકડ દાનની મહત્તમ

મુખ્યમંત્રીએ ૧૮૭ કરોડની ફાળવણી કરી

હર હર મહાદેવ, રાજકોટ શહેરના પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરનો જિર્ણોદ્ધાર થશે

મંદિરના જિર્ણોદ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરવામાં આવશે

રાજકોટ, તા.૨૦ | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગર પાલિકાને રામનાથ મહાદેવ મંદિર અને આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના કામો માટે ૧૮૭ કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. રાજકોટ શહેર આજી નદીના પૂર્વ અને પશ્ચિમ બે બંધ કાંઠે જડાવી વિકાસને કારણે વિકસ્યું છે. એટલું જ નહિ, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કરવા માટે ઈન્ટરસેક્ટર લાઈનની કામગીરી પણ પ્રગતિમાં છે. શહેરની મધ્યમાંથી પસાર થતી આજી નદીના પશ્ચિમ કિનારે આવેલું અતિ પ્રાચીન અને સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિર ડેવલપ કરવા માટેની કામગીરી ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મહાનગરપાલિકાને તબદીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ



આ સંદર્ભમાં રાજકોટ મહાનગરપાલિકાએ ૧૧ કિ.મી આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરી અતિ પ્રાચીન રામનાથ મંદિરના ડેવલપમેન્ટ સાથે સુસંગત કરવાની દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ કાંચનાન્સ બોર્ડ મારફતે રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી

શહેરી વિકાસ યોજનાના આગવી ઓળખ ઘટકના આ કામોને અનુમોદન આપ્યું છે. આના પરિણામે હવે ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂ. ૧૮૭ કરોડ પ્રથમ ફેઝમાં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીશ્રીએ આપી છે. રાજકોટ મહાનગરપાલિકા હવે શ્રી રામનાથ મહાદેવ મંદિરના જિર્ણોદ્ધાર ઉપરાંત વિશાળ પાર્કિંગ એરિયા, ટેમ્પલ પ્લાઝા, કિઓસ્ક, લેન્ડ સ્કેપીંગ જેવી વિકાસ કામગીરી હાથ ધરશે તથા ભવિષ્યમાં વધુ ડેવલપમેન્ટ માટેની જગ્યા પણ રાખશે. આ ઉપરાંત આજી નદીમાં મંદિરની પાછળના ભાગમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવશે. મુખ્યમંત્રીએ આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરીને કારણે રાજકોટમાં આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અને અતિ પ્રાચીન રામનાથ મહાદેવ મંદિરના વિકાસ કામો જડાવવાની સાકાર થશે.

અમે તૈયાર છીએ... અમદાવાદના યુવાનોમાં ગરબા રમવા માટે અનેરો યતનગાઠ



અમદાવાદ | નવરાત્રિ આવતા દરેક રાસ ગરબા રમનાર રસિકો દ્વારા ગરબા ની પ્રેક્ટિસ કરે છે તેવી રીતે પંચગત રાસ-ગરબા દ્વારા આજે ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી. હાલ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રિની તૈયારીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ટીમ દ્વારા કાર્ડિયોલોજી કરતા જાણવા મળ્યું કે મહિલા હિન્દી ભાષા બોલી અને સમજી શકે છે નર્મદા “સખી” વન સ્ટોપ સેન્ટરે ગુમ થયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મહિલાના કુટુંબજનોને શોધવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યું હતું

રાજપીપલા, તા.૨૦ | ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલીકૃત તેમજ નર્મદા જિલ્લાના મહિલા અને બાળ અધિકારીની કચેરી સંલગ્ન “સખી” વન સ્ટોપ સેન્ટર, નર્મદા ખાતે તા. ૦૫/૦૮/૨૦૨૨ ને સોમવારના રોજ ટાઉન પો.સ્ટે. દ્વારા એક અજાણી મહિલાને આશ્રય અને પરામર્શ માટે મુકવામાં આવ્યા હતા. ટીમ દ્વારા મહિલાનું કાર્ડ-સર્વેલિંગ કરતા જાણવા મળ્યું કે તેઓ માત્ર હિન્દી ભાષા બોલી અને સમજી શકે છે. કાર્ડ-સર્વેલિંગ બાદ મહિલાને મેડિકલ સહાયની જરૂર જણાતા સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા તેઓને રાજપીપલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દસ દિવસ સુધી દાખલ કરવામાં આવ્યા હતાં. જે દરમિયાન મહિલા સાથે રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશનના બે મહિલા



કર્મચારીઓને તેમની સારસંભાળ અને સુરક્ષા માટે રાખવામાં આવ્યા હતા. સારવાર બાદ મહિલાને ફરીથી “સખી” વન સ્ટોપ સેન્ટર ખાતે લાવી સખી વન સ્ટોપના કર્મચારીઓ અને ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગુમ થયેલ મહિલાના કુટુંબજનોને શોધવા માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યું હતું. અંતે પરિવાર સાથે સંપર્ક થતા જાણવા મળ્યું કે ગુમ થયેલ મહિલા ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાની વતની છે અને તેઓ માનસિક રીતે અસ્વસ્થ હતા.

શિક્ષક ભરતી કૌભાંડ મામલે મૂળ ફરિયાદી પુરાવા સાથે પોલીસ મથકે પહોંચ્યા

ખેડા, તા. ૨૦ | ખેડામાં વિદ્યાસહાયકો-શિક્ષક ભરતી કૌભાંડ મામલે નડીયાદ પશ્ચિમ પોલીસે કોર્ટમાં ફરિયાદ રજૂ કરી છે. મૂળ ફરિયાદી જિજ્ઞાસા પટેલ પુરાવા સાથે પશ્ચિમ પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તમને કૌભાંડની ફરિયાદમાં પોલીસે સાક્ષી બનાવ્યા છે. સાક્ષી તરીકે જિજ્ઞાસાબેન પટેલનું પોલીસે નિવેદન લીધું હતું. તેમાં જિજ્ઞાસાબેને જણાવ્યું હતું કે ભરતીમાં અન્યાય થતા અમે કોર્ટમાં ફરિયાદ કરી હતી. બોગસ દિવાળી સર્ટીઓ રજૂ કરીને તત્કાલીન DPO એ કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું હતું. કૌભાંડ મામલે છેલ્લા ૧૨ વર્ષથી લડાઈ ચાલુ હોવાનું જિજ્ઞાસાબેને જણાવ્યું હતું. પોલીસે વારંવાર કોર્ટમાં ખોટા જવાબો રજૂ કર્યા હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ લાંબી લડત બાદ ફરિયાદ નોંધાતા આનંદની અનુભૂતિ થઈ હોવાનું જિજ્ઞાસાબેને ઉમેર્યું હતું.

૨૦થી વધુ કોઝવે ઉપર પાણી ફરી વળ્યાં ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીઓમાં ઘોડાપુર

ડાંગ, તા. ૨૦ | જિલ્લામાં પડી રહેલા ધોધમાર વરસાદ સાથે ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાં ઘોડાપૂર જોવા મળ્યા છે. ધસમસતા પાણીને કારણે જિલ્લામાં ૨૦થી વધુ નાના મોટા કોઝવે ઉપર પાણી ફરી વળતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા જ્યારે હજારો લોકો અટવાઈ પડ્યા હતા. ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક છૂટો છવાયો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાછોતરા વરસાદને પગલે ખેડૂતોને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ પશુના પણ મૃત્યુ નોંધાયા છે. સતત વરસાદને લીધે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. આ વરસાદને પગલે જિલ્લાના ૨૦ જેટલા લો લેવલ કોઝ વે, અને નીચાણવાળા માર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખી આ તમામ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, પશુપાલકો તથા વાહન ચાલકોને આ માર્ગો ન બંદલે, તંત્ર એ સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.



મહિલાઓ અને બાળકોને નદીમાં પાણી ઓસરે ત્યાં સુધી રાહ જોવી પડી

જિલ્લાના ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને નદીઓમાં આવેલ ઘોડાપૂરને લીધે ૨૦ જેટલા લોલેવલના કોઝવે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં મુખ્ય સતી-વાંગણ-કુતરનાચ્યા રોડ, નાનાપાડા-કુમારબંધ-બોરદહાડ રોડ, ઘોડવહળ વી.એ.રોડ, ખાતળ ફાટકચી ઘોડી રોડ, માછળી-થિખલા-દિવડ્યાવન રોડ, ઢાઢરા વી.એ.રોડ, વાંજટયાંબા-કોચલીપાડા રોડ, સાથે દુલધા, કચંગપાડા, બંધપાડા જેવા મુખ્ય કોઝવે સહિત અનેક નાના મોટા માર્ગો અવરોધાતા ડાંગ જિલ્લાના હજારો માણસો અટવાઈ પડ્યા હતા.

કાલોલના યુવાનો લેહ-લદાખના પેગોગ લેક પાસે ૧૩,૮૬૨ ફૂટની ઊંચાઈ પર ગરબા રમ્યા

પંચમહાલ, તા.૨૦ | ગુજરાતીઓને ગરબા જીવથી પણ વધારે ગમી છે. ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગુજરાતી લોકો ગરબા રમવા લાગે છે. પછી ભલેને ગમે તે જગ્યા હોય. માત્ર નવરાત્રિમાં જ ગરબા જોવા મળે તે જરૂરી નથી. ગુજરાતીઓ તો રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન ગમે ત્યાં ગરમે રમવા લાગે છે. ગુજરાતના ગરબાનો જલ્દો વિદેશમાં પણ જોવા મળે છે. ત્યારે પંચમહાલના કાલોલના યુવાનોએ લેહ લદાખની મુલાકાત દરમિયાન ગરબા રમ્યા હતા. પંચમહાલના કાલોલના યુવાનોએ લેહ લદાખની મુલાકાત દરમિયાન સાયનસ ડિસ્ટ્રી તાપ માનની કડકડતી ઈંટીમાં ગરબાની રમઝટ બોલાવી હતી. આ યુવાનોએ “કૃષ્ણ ભગવાન હાલ્યા દ્રારકા” ગીતના તાલ પર ગરબા રમ્યા હતા. આ યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

સાથી હાથ બઢાના ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વાઇબ્રન્ટ દ્વારા આયોજન

છેવાડાના અંતરીયાળ વિસ્તારોમાં જરૂરિયાત મંદ બાળકોને એજ્યુકેશન કીટ અને રાશન કીટનું વિતરણ કરાવ્યું

કાર્યક્રમમાં ૪૩૦થી વધુ પરિવાર અને બાળકોએ લાભ લીધો

ડિકેન્સ કોરિડોરમાં ગુજરાતનો સમાવેશ કરવા રજૂઆત કરાઈ

અમદાવાદ, તા. ૨૦ | કેન્દ્ર સરકાર આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ હવે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માંગે છે. સેનાની જરૂરીયાતો હેતુએ પૂરી થાય અને દરેક વસ્તુનું ઉત્પાદન દેશમાં થાય તે માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે. આ માટે ઉત્તર પ્રદેશમાં સંરક્ષણ કોરિડોર બનાવવાની તૈયારી પણ ચાલી રહી છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ પ્રધાનમંત્રીને પત્ર લખીને ગુજરાતનો સમાવેશ ડિકેન્સ કોરિડોરમાં કરવા માટે રજૂઆત કરી છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા ગુજરાતનો સમાવેશ ડિકેન્સ કોરિડોરમાં કરવા માટે પીએમ મોદીને પત્ર લખવામાં આવ્યો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ પથીક પટવારીએ કહ્યું કે, ગુજરાત પાસે ડિકેન્સ કોરિડોર માટેની તમામ સુવિધા અને ક્ષમતા છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ડિકેન્સ કોરિડોર હશે તો ડિકેન્સ સેક્ટરને ફાયદો થશે. તેમણે કહ્યું કે, આ માટે ગુજરાત પાસે ઉત્તમ માળખું છે. ગુજરાત ડિકેન્સ સાથેનો ઉત્પાદનમાં ગેમચેન્જર સાબિત થશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ૪૨ દરિયાઈ બંદર, ૧૭ એરપોર્ટ અને એરસ્ટ્રીપની વ્યવસ્થા છે. તો રાજ્યમાં ૭૫ હજાર કિલોમીટરના રસ્તા અને ૮ હજાર કિલોમીટરનો રેલવે ટ્રેક પણ છે.

CAR WORLD AUTO GARAGE

Karan Panchal
+91 9427796859
Mahesh Gajnotar
+91 9824699827

Shop No. 1, Radhe Hills, Nr. Rameshwar Transport, Mahemadabad Road, Hathijan, Gujarat-382 445.

તાપાસમાં મોટું નેટવર્ક બહાર આવવાની શક્યતા

આરોપીઓ પાસેથી ૫૭ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતા વિવિધ દિશામાં તપાસ શરૂ

અમદાવાદમાં પાન પાર્લરની આડમાં ડ્રગ્સનું વેચાણનો પર્દાફાશ, બે આરોપીની ધરપકડ

અમદાવાદ, તા. ૨૦ | ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર ખુબ ચાલી રહ્યો છે. ડ્રગ્સ તથા નશીલા પદાર્થોની હેરાફેરીનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પોલીસે પણ અત્યાર સુધી આવા ઘણા આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે અમદાવાદ એસએચ ટીમે મેકેડોન ડ્રગ્સ સાથે જોધપુર વિસ્તારમાંથી બે વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને આરોપીઓ પાસેથી ૫૭ ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. એસએચએ સાત લાખના મુદ્દા માલ સાથે બંનેની ઝડપી લીધા છે. ડ્રગ્સના બંધાણી બંનેલા બંને વ્યક્તિઓ હવે ડ્રગ્સ વેચતા હતા. આ બંને આરોપીઓ મેકેડોન ડ્રગ્સ વેચતા હોવાની હકીકત આધારે SOGની ટીમે જોધપુર વિસ્તારમાં રેડ કરી પરબત ઝાલા અને ઉશામા બક્ષીની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપી ઓડાના મકાનમાં રહેતાં અને પાન પાર્લરની આડમાં MD ડ્રગ્સ વેચતા. પકડાયેલ આરોપી પરબત ઝાલા પાસેથી પોલીસે રૂ.૨૧૦ ગ્રામ જેટલું MD ડ્રગ્સ કબજે કર્યું છે. જ્યારે ઉશામા પાસેથી ૩૩ ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું.

લોક પત્રિકા હવે અહીં પણ

ભારતની નં.૧ ન્યૂઝ એપ

dailyhunt

પત્રોપજના સમાચારની અપડેટ જોવા માટે આજે જ ડેઈલી હન્ટમાં લોક પત્રિકાને ફોલો કરો